



International Year
of Cooperatives

Cooperatives Build a Better World

સિહોર નાગરિક સહકારી બેંક લિ.

સધ્ધરતા - સલામતી - સેવા

ઓડીટ વર્ગ : “અ”



૫૯ મો

વાર્ષિક અહેવાલ

૨૦૨૪-૨૦૨૫

0%
Net NPA
BANK

હેડ ઓફિસ : શ્રી ભોગીલાલ લાલાણી માર્ગ, સિહોર - ૩૬૪ ૨૪૦.

ફોન & ફેક્સ : (૦૨૮૪૬) ૨૨૨૦૭૪, ૨૨૨૦૭૫

E-mail : sihor@snsb.co.in, sihorho@snsb.co.in

website : www.snsb.co.in



બેન્કના વિકાસ અને સધસ્તાના સોપાનો

અનુ.	વિગત	૧૯૬૭	૧૯૭૭	૧૯૮૭	૧૯૯૭	૨૦૨૨	૨૦૨૩	૨૦૨૪	૨૦૨૫
૧	સભાસદ સંખ્યા (અ) વર્ગ	૩૪૦	૮૨૭	૨૧૫૩	૨૧૫૩	૨,૨૧૪	૨,૨૨૯	૨,૩૩૮	૨,૨૫૫
	(બ) વર્ગ	---	---	૫,૨૨૧	૬,૫૯૯	૧૪,૨૪૭	૧૪,૨૬૪	૧૪,૩૦૫	૧૪,૩૪૧
૨	શેર ભંડોળ 'અ' વર્ગ	૧,૨૯,૫૯૦	૪,૭૧,૧૮૦	૧૯,૨૦,૭૪૦	૪૮,૨૧,૨૦૦	૮૦,૭૨,૨૭૦	૯૦,૨૮,૪૭૦	૯૭,૫૭,૯૨૦	૧,૦૭,૦૯,૫૨૦
	'બ' વર્ગ	---	---	૧૭,૯૫,૭૫૦	૬૦,૭૬,૬૦૦	૧,૫૪,૪૦,૨૫૦	૧,૫૬,૫૦,૪૫૦	૧,૭૭,૬૦,૦૫૦	૧,૮૯,૩૨,૩૦૦
૩	રીઝર્વ ફંડ તથા અન્ય રીઝર્વ્સ	૮૦૨	૩,૮૩,૪૧૩	૫૯,૫૩,૯૮૨	૪,૧૩,૫૧,૧૦૦	૨૧,૯૯,૫૦,૪૮૪	૨૪,૪૬,૫૦,૩૫૮	૨૬,૦૩,૭૧,૯૪૦	૨૮,૩૮,૯૪,૨૪૧
૪	થાપણો :	૨,૬૫,૬૮૫	૫૫,૧૮,૪૭૦	૫,૫૩,૬૯,૩૫૧	૨૫,૦૬,૩૭,૭૯૩	૧,૩૨,૦૮,૩૫,૧૯૪	૧,૩૨,૮૫,૫૧,૩૯૯	૧,૩૮,૫૯,૧૦,૧૫૬	૧,૫૦,૦૨,૨૬,૬૨૯
૫	ધિરાણો :	૩,૬૬,૦૯૫	૩૪,૧૭,૮૯૦	૩,૮૮,૧૦,૪૯૬	૧૭,૫૪,૩૦,૫૮૩	૬૯,૬૮,૬૩,૯૯૨	૭૩,૨૦,૪૩,૧૪૩	૮૪,૧૨,૭૧,૧૯૨	૯૫,૮૦,૭૨,૮૫૩
૬	કાર્યકારી મુડી	૪,૭૦,૪૮૫	૬૯,૪૯,૬૫૩	૭,૬૧,૪૮,૪૫૮	૩૫,૧૦,૧૬,૨૭૧	૧,૭૭,૯૦,૨૮,૦૯૨	૧,૮૦,૯૧,૫૯,૪૮૦	૧,૯૦,૧૯,૬૮,૩૦૧	૨,૦૪,૨૧,૯૮,૮૩૨
૭	નફો	૧,૧૬૮	૨,૧૮,૨૧૯	૮,૯૪,૪૭૧	૫૫,૫૨,૦૪૪	૧,૭૪,૭૬,૧૮૪	૧,૬૯,૮૧,૭૨૦	૧,૮૩,૯૩,૬૫૯	૧,૯૭,૩૮,૮૮૫
૮	ઓડીટ વર્ગ	---	'અ'	'અ'	'અ'	'અ'	'અ'	'અ'	'અ'
૯	કીવીન્ડ	---	૯ %	૧૨ %	૧૫ %	૧૩ %	૧૩ %	૧૩ %	૧૩ % (સુધિત)



૫૯ મી વાર્ષિક સાધારણ સભાની નોટીસ

આથી સિહોર નાગરિક સહકારી બેન્ક લિ., ના સર્વ સભાસદશ્રીઓને જાણ કરવામાં આવે છે કે, આપણી બેન્કની સને ૨૦૨૪-૨૦૨૫ નાં વર્ષની ૫૯ મી વાર્ષિક સાધારણ સભા નીચેની કાર્યસૂચિ માટે તા. ૨૦-૦૭-૨૦૨૫ રવિવાર નાં રોજ સાંજનાં ૫-૦૦ કલાકે ગુજરાતી કંસારા જ્ઞાતિની વાડી, કાલિકા માતાનો ખાંચો, કંસારા બજાર, સિહોર ખાતે રાખવામાં આવી છે. તો સર્વે સભાસદશ્રીઓને સમયસર હાજરી આપવા વિનંતી છે.

: કાર્યસૂચિ :

- (૧) તા. ૨૫-૦૨-૨૦૨૫ના રોજ મળેલ ખાસ સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવા બાબત.
- (૨) તા. ૩૧-૦૩-૨૦૨૫ના રોજ પુરા થયેલ વર્ષના ઓડીટ થયેલા હિસાબો તથા ઓડીટર્સ રીપોર્ટ મંજૂર કરવા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી રજુ થયેલ કામકાજનો અહેવાલ મંજૂર કરવા બાબત.
- (૩) સને ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભલામણ કરેલ ચોખ્ખા નફાની ફાળવણી મંજૂર કરવા બાબત.
- (૪) સને ૨૦૨૫-૨૦૨૬ નાં નાણાંકીય વર્ષ માટે ઓડીટરની નિમણૂક બાબત.
- (૫) પેટા નિયમ નં. ૬ મુજબ બહારથી ભંડોળ એકત્ર કરવાની મહત્તમ મર્યાદા નક્કી કરવા બાબત.
- (૬) સમાધાનથી બંધ થયેલ ખાતાઓને બહાલી આપવા અંગે.
- (૭) ચેરમેનશ્રી તરફથી અગર તેઓશ્રીની મંજૂરીથી બેન્કના હિતમાં જે કંઈ રજુ થાય તે ઉપર ચર્ચા વિચારણા કરી ચોગ્ય કરવા બાબત.

સિહોર.

તા. ૦૪-૦૭-૨૦૨૫

બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સુચનાથી
વામનભાઈ જે. મહેતા
જનરલ મેનેજર

નોંધ :

- (૧) સભા મળવાના વખતથી અડધા કલાક સુધીમાં સભાનું કોરમ નહિ થાય તો સભા અડધા કલાક માટે મુલતવી રાખ્યા બાદ શરૂ કરવામાં આવશે જેમાં કોરમનો બાધ રહેશે નહિં.
- (૨) તા. ૩૧-૦૩-૨૦૨૫ નાં આખરનાં વર્ષનું સરવૈયું તથા નફા-નુકશાન ખાતુ હેડ ઓફિસ તથા શાખાઓમાંથી માંગણી થયે/ઓળખપત્ર રજુ થયે વિના મૂલ્યે મળી શકશે.
- (૩) જે સભાસદોને તા. ૩૧-૦૩-૨૦૨૫ નાં રોજ પૂરા થયેલ વર્ષ આખરનાં હિસાબો સબંધી કોઈ વિશેષ માહિતીની જરૂરીયાત હોય તેમણે સાધારણ સભાના ૭ (સાત) દિવસ અગાઉ હેડઓફિસ/શાખાઓમાં લેખીત માંગણી રજુ કરવી.

બેન્કના કામકાજનો સમય

વિગત	બેન્કીંગ કામકાજ	લોકર ઓપરેશન
સોમવાર થી શનિવાર	સવારના ૧૦-૩૦ કલાક થી બપોરના ૨-૩૦ કલાક સુધી તથા બપોરના ૩-૦૦ થી ૪-૦૦ કલાક સુધી	સવારના ૧૦-૩૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક સુધી

નોંધ : દર માસના બીજા તથા ચોથા શનિવારે બેન્કમાં રજા રહેશે.



પદ મો વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૦૨૫

સહકારી ભાઈઓ તથા બહેનો,

આપ સૌની અવિરત શુભકામનાઓ, અતુટ વિશ્વાસ અને નિરંતર સહકારના સથવારે, આપણી બેંકે સફળતાના પદ શાનદાર વર્ષો પુર્ણ કરીને આજે ૬૦ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે. આ પળે આપણી બેંકની પદમી વાર્ષિક આધારણ સભાના આપ સર્વેનું હૃદયપુર્વક સ્વાગત કરતા અને ૩૧-૦૩-૨૦૨૫ના રોજ પુરા થતા વર્ષના વાર્ષિક હિસાબો આપ સમક્ષ રજુ કરતા મને અત્યંત આનંદ, ગૌરવ અને સંતોષની લાગણી થાય છે.

આ અહેવાલમાં દર્શાવેલ પ્રત્યેક હકીકત એ વાતની સાક્ષી પુરે છે કે, વર્તમાન સમયના પડકાર જનક સંજોગો છતાં પણ, આપણી બેંકે અસાધારણ પ્રગતિ હાંસલ કરેલ છે. આ સિદ્ધિ આપ સર્વેના વિશ્વાસનું પરીણામ છે. ચાલો આપણે સૌ સાથે મળીને આપનારા ભવિષ્ય માટે નવા આયામો સર કરવા સંકલ્પબદ્ધ થઈએ.

બેન્કની દરેક શાખાઓની આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

વિગત	સિહોર શાખા	દાણાપીઠ શાખા ભાવનગર	શાસ્ત્રીનગર શાખા ભાવનગર	ગારીયાધાર શાખા	કુલ
સભાસદ સંખ્યા	૨૨૫૫	૭૨૬૫	૭૦૭૬	૯	૧૬૫૯૬
થાપણો ₹	૧,૧૨,૨૬,૫૧,૪૪૯-૭૯	૧૭,૦૯,૫૪,૬૯૯-૮૩	૨૦,૬૬,૨૦,૪૮૦-૩૦		૧,૫૦,૦૨,૨૬,૬૨૯-૯૨
ઘીરાણો ₹	૩૯,૩૨,૦૮,૨૦૩-૨૮	૩૨,૩૫,૦૮,૨૦૪-૯૯	૨૪,૧૩,૫૬,૪૪૪-૮૦		૯૫,૮૦,૭૨,૮૫૩-૦૭

ઓડિટ તથા નફાની જાળવણી :

સને ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષના હિસાબોનું ઓડિટ મે. DSKHTP & Associates LLP, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ - રાજકોટ તરફથી કરવામાં આવેલ છે અને તેઓશ્રીએ બેન્કની કામગીરીથી સંતોષ વ્યક્ત કરેલ છે. તેમજ ઇન્કમેટેક્સના હેતુ સબબ ટેક્સ ઓડિટ નિયત સમય મર્યાદામાં કરાવી અને તેનું જરૂરી રીટર્ન નિયત સમય મર્યાદામાં ફાઈલ કરાવી દેવામાં આવશે. તા. ૩૧-૦૩-૨૦૨૫ ના રોજ પુરા થતા વર્ષનાં અંતે ₹ ૩,૮૩,૯૧૩-૦૦ બિલ્ડીંગ તથા ફર્નિચર ફિક્સર્સ એન્ડ ડેસ્ટોક વિગેરે ઉપર ઘસારાની જોગવાઈ, ₹ ૧,૬૮,૦૦,૦૦૦-૦૦ અન્ય જોગવાઈ કર્યા બાદ ચાલુ સાલનો નફો ₹ ૩,૦૭,૩૮,૮૮૫-૧૦ થાય છે જેમાંથી ₹ ૧,૧૦,૦૦,૦૦૦-૦૦ ઇન્કમ ટેક્સ અંગેની જોગવાઈ કર્યા બાદ કુલ ચોખ્ખો નફો ₹ ૧,૯૭,૩૮,૮૮૫-૧૦ થાય છે. ગુજરાત રાજ્ય સહકારી અધિનિયમ ૧૯૬૧ની જોગવાઈઓ મુજબ બેન્કનાં બોર્ડ ઓફ ડીરેક્ટર્સે સભાસદોને ૧૩% મુજબ ડીવીડન્ડ વહેંચવાની ભલામણ કરેલ છે. પેટા નિયમ પદ તથા નં. પદ ને આધીન રહીને નીચે જણાવ્યા મુજબ નફાની વહેંચણીની ભલામણ કરી છે જેને આપ સર્વો બહાલી આપશો તેવી આશા રાખુ છું.



કુલ યોજનો નફો ₹ ૧,૯૭,૩૮,૮૮૫-૧૦ ની ફાળવણી

અનુક્રમ નંબર	પેટા નિયમ નંબર	ફાળવણીની વિગત	ટકાવારી	ફાળવેલ રકમ ₹
૧	૫૮ (૧)	શ્રી અનામત ભંડોળ ખાતે	૩૫.૦૦ %	૬૯,૦૮,૬૧૦-૦૦
૨	૫૮ (૨)	શ્રી શિક્ષણ ફાળા ખાતે	૧.૫૨ %	૩,૦૦,૦૦૦-૦૦
૩	૫૮ (૩)	શ્રી સભાસદોને ૧૩% મુજબ ડીવીડન્ડ આપવા ખાતે	૧૮.૧૨ %	૩૫,૭૭,૩૫૦-૦૦
૪	૫૮ (૪)	શ્રી ધર્માદા ફંડ ખાતે	૧.૨૧ %	૨,૩૮,૦૦૦-૦૦
૫	સહકારી કાયદાની કલમ ૬૭ (ક)	શ્રી બેંક એન્ડ ડેબ્ટ રીઝર્વ ફંડ ખાતે	૧૫.૦૦ %	૨૯,૬૦,૮૩૨-૭૭
		કુલ :- (૧)	૭૦.૮૫ %	૧,૩૯,૮૪,૭૯૨-૭૭
		કુલ નફો ₹ ૧,૯૭,૩૮,૮૮૫-૧૦ પૈસા માંથી ઉપર કુલ (૧) મુજબ ₹ ૧,૩૯,૮૪,૭૯૨-૭૭ પૈસા બાદ જતાં બાકી રકમ ₹ ૫૭,૫૪,૦૯૨-૩૩ પૈસા રહે છે જેની ફાળવણી નીચે મુજબ કરવી.		
૬	૫૯ અ (૧)	અન્ય ફંડમાં ફાળવણી :- શ્રી મકાન ફંડ ખાતે	૭.૬૦ %	૧૫,૦૦,૦૦૦-૦૦
	અ (૩)	શ્રી સભાસદ કલ્યાણ ફંડ ખાતે	૦.૭૦ %	૧,૩૭,૯૪૫-૬૭
	અ (૪)	શ્રી સ્ટાફ બેનીફીટ ફંડ ખાતે	૧.૦૧ %	૨,૦૦,૦૦૦-૦૦
	અ (૫)	શ્રી બેન્ક ડેવલોપમેન્ટ ફંડ ખાતે	૦.૫૧ %	૧,૦૦,૦૦૦-૦૦
	અ (૭)	શ્રી મહોત્સવ ફંડ ખાતે	૦.૦૮ %	૧૬,૧૪૬-૬૬
	અ (૯)	શ્રી ઇન્વેસ્ટમેન્ટ ફલ્ક્યુએશન ફંડ ખાતે	૧૫.૨૦ %	૩૦,૦૦,૦૦૦-૦૦
		શ્રી સાયબર સીક્યુરીટી ફંડ ખાતે	૪.૦૫ %	૮,૦૦,૦૦૦-૦૦
		કુલ :- (૨)	૨૯.૧૫ %	૫૭,૫૪,૦૯૨-૩૩
		કુલ સરવાળો : કુલ (૧) + (૨) =	૧૦૦.૦૦ %	૧,૯૭,૩૮,૮૮૫-૧૦

ફંડો :

કોઈપણ નાણાંકીય સંસ્થાનો વિકાસ અને સદ્ધરતા તેના અનામત ભંડોળ ઉપરથી ખ્યાલ આવે છે. બેન્કનાં રીઝર્વ ફંડ તથા અન્ય વિવિધ ફંડો કુલ ₹ ૨૮,૩૮,૯૪,૨૪૧-૨૦ છે. જેનો આંક ભરપાઈ થયેલ શેર ભંડોળથી ઘણો જ ઉંચો છે, જે બેન્કની સદ્ધરતા દર્શાવે છે.

થાપણો :

નિવેદનના વર્ષમાં બેંકની થાપણમાં ₹ ૧૧૪૩.૧૬ લાખ ના વધારા સાથે કુલ થાપણ ₹ ૧,૫૦,૦૨,૨૬,૬૨૯.૯૨ થયેલ છે. થાપણદારોએ બેંક પ્રત્યે અડગ, અતુટ વિશ્વાસ દાખવી પ્રેરણાદાયક સહયોગ પુરો પાડેલ છે, જે બદલ બેંક તેમના સહભાગી સભાસદો, થાપણદારો તથા શુભેચ્છકોનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.



ધીરાણ :

સભાસદોને તેઓની આર્થિક જરૂરીયાતો પૂર્ણ કરવા તથા વેપાર-ધંધા, ઉદ્યોગોનાં વિકાસ માટે ધીરાણ મેળવવાની જરૂરીયાત રહે છે. આ માટે ખુબ જ સરળ અને સુલભ રીતે તથા ઝડપી ધીરાણ મળે તેવી આપણી ધીરાણ નીતિ અપનાવેલ છે. જેનાં ફળ સ્વરૂપે ચાલુ સાલે ₹ ૧૧૬૮.૦૨ લાખના વધારા સાથે કુલ ધીરાણ ₹ ૯૫,૮૦,૭૨,૮૫૩.૦૭ થયેલ છે.

(NPA) પ્રોવિઝન્સ :

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ આપણી બેન્કનાં જે ધીરાણ ખાતાઓ એન.પી.એ. કક્ષામાં આવેલ હોય તેવા ધીરાણ ખાતાનું વ્યાજ તથા લવાઈ દાવાઓ કરેલ હોય તેવા ખાતાનું વ્યાજ નફામાં નહીં ઉમેરતા મળવાપાત્ર વ્યાજ ખાતે પ્રોવિઝન્સ કરીએ છીએ અને જ્યારે વાસ્તવિક વસુલાત આવે ત્યારે ધીરાણ ખાતામાં વ્યાજ ઉધાર કરીએ છીએ. આમ છતાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનાં નીતિ-નિયમો મુજબ આવા ઓવરડ્યુ થયેલા ખાતેદારો માટે એન.પી.એ. ની કરવાની જરૂરી જોગવાઈઓની રકમ ₹ ૨૯૪.૭૬ લાખની સામે આપણે ₹ ૯૧૫.૧૭ લાખની જોગવાઈ કરી શક્યા છીએ. જે જરૂરીયાત કરતા ₹ ૬૨૦.૪૧ લાખ વધુ છે. જે બેંકની સધ્ધરતા દર્શાવે છે.

મૂડી પર્યાપ્તતા (CRAR) :

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્કોની મિલ્કતો સામેનાં સંભવીત જોખમોને પહોંચી વળવા માટેની મૂડી પર્યાપ્તતાનું ધોરણ (Capital to Risk Weighted Assets Ratio-CRAR) લાગુ પાડવામાં આવેલ છે. તા. ૩૧-૦૩-૨૦૨૫ ના રોજ પુરા થતા વર્ષનાં અંતે આર.બી.આઈ.ની સુચના મુજબ આ ધોરણ Tier-2 બેંક માટે ૧૨% હોવું જોઈએ જેના બદલે આપણી બેન્કનો આ રેશીયો ૨૬.૧૧% છે, જે આપણી બેન્કની સધ્ધરતા બતાવે છે.

ડીપોઝીટ ઈન્સ્યોરન્સ :

બેન્કનું મેનેજમેન્ટ સભાસદોનાં હિતને પ્રાધાન્ય આપવા ઉપરાંત થાપણદારોનાં હિતને પણ સતત દ્રષ્ટિ સમક્ષ રાખે છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ડીપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ કેડીટ ગેરેન્ટી કોર્પોરેશન મુંબઈને તેના મોકલવાના થતા પ્રિમીયમની રકમ થાપણદારોનાં ઉત્તમ હિતમાં નિયત સમય મર્યાદા પહેલા જ મોકલી આપવામાં આવે છે. નિવેદનના વર્ષ દરમિયાન આ પ્રિમીયમની રકમ કુલ ₹ ૧૭,૯૪,૬૫૦-૦૦ ચુકવેલ છે.

ઓડિટ/કોન્કરન્ટ ઓડીટ :

પ્રસ્તુત વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષના હિસાબોનું ઓડીટ DSKHTP & Associates LLP, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, રાજકોટે કરેલ છે અને સતત ઓગણીસમાં વર્ષે ઓડીટ વર્ગ ‘અ’ એનાયત થયેલ છે. તેમજ આપણી બેંકનું વર્ષ ૨૦૨૪-૨૫ નું કોન્કરન્ટ ઓડીટ જે. બી. વનરા એન્ડ કું., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ભાવનગર દ્વારા કરવામાં આવેલ છે જેણે બેંકની કામગીરીથી સંતોષ વ્યક્ત કરેલ છે.

ગ્રાહક-સેવા :

બેંકે તેની ઝડપી અને વિનયશીલ બેંકીંગ સેવામાં વધારો કરતા તમામ શાખાઓમાં સી.બી.એસ. (Core Banking Solution) ની સુવિધા, CTS ક્લીયરીંગની સુવિધા, RTGS/NEFT ની સુવિધા, થાપણદારો માટે MIS (મંથલી ઇન્કમ સ્કીમ) ની સુવિધા, આધાર કાર્ડ આધારીત ગેસ સબસીડી, SMS બેંકીંગ, સંપૂર્ણ વાતાવુક્તિત બેંક જેવી સુવિધા શરૂ છે. ગ્રાહક સેવાનું સ્તર ઉંચે લઈ જવા માટેના આપણા સતત પ્રયત્નો છે. બેન્કને પ્રગતિના પંથે લઈ જવા માટે મેનેજમેન્ટનાં પ્રયત્નોમાં સભાસદો, થાપણદારો, ધીરાણ મેળવનારાઓ તથા બેન્કના કર્મચારીઓને પોતાનો ઉમદા સહકાર આપી બેન્કની પ્રગતિમાં યશભાગી બનવા ભારપૂર્વક અનુરોધ કરૂ છું.



ધીરાણ વસુલાત

ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન પણ બેન્કની વસુલાતની કામગીરી પ્રમાણમાં સંતોષકારક રહેલ છે. બેન્કનાં કર્મચારીઓ દ્વારા મુદતવીતી બાકીદારોની તેમના ધંધા અગર રહેણાંકના સ્થળે રૂબરૂ મુલાકાત લઈ વસુલાતની કામગીરી સમજાવટથી કરવામાં આવે છે. આમ છતાં જો કરજદાર તરફથી પુરતો સહકાર ન મળે તો વસુલાત કરવા અનિચ્છાએ પણ જપ્તી સહિત બેન્કને આકરા પગલાંઓ લેવાની ફરજ પડે છે.

સભાસદ સહાય :

બેંક આપના અને આપના પરિવારના હિત માટે કટિબદ્ધ છે. તેથી બેન્ક તરફથી સભાસદ તથા તેમના ઉપર આધારીત કુટુંબને સીટી સ્કેન કરવાના સમયે નાણાંકીય સહાય આપવામાં આવે છે. તેમજ જ્યારે કોઈ સભાસદનું અવસાન થાય ત્યારે તેમના વારસદારોને નિયત સમય મર્યાદામાં જરૂરી અરજી ફોર્મ રજુ કર્યેથી રૂ. ૫૦૦૦/- ની મરણોત્તર સહાય આપવામાં આવે છે. નિવેદન વર્ષ દરમિયાન ૩૦ કિસ્સામાં મરણોત્તર સહાય ચુકવેલ છે.

શ્રદ્ધા સુમન :

અત્યંત દુઃખ અને દિલગીરી સાથે જણાવવાનું કે, ચાલુ વર્ષ દરમિયાન આપણી બેંકના ડિરેક્ટર શ્રી ધનસુખભાઈ ડી. રાઠોડ તથા પૂર્વ જનરલ મેનેજર શ્રી જીતેન્દ્રભાઈ જી. જાની નું દુઃખદ અવસાન થયેલ છે.

બેંકના વિકાસ અને પ્રગતિમાં તેમના માર્ગદર્શન, દ્રષ્ટિ અને સમર્પણ ભાવનાએ બેંકને નવી ઉંચાઈઓ સર કરવામાં મદદ કરી છે. બેંક હંમેશા તેમના યોગદાન બદલ ઋણી રહેશે.

દિવંગત આત્માઓને પરમ શાંતિ મળે તેવી પ્રાર્થના સહ તેઓના પરિવારો પ્રત્યે અમારી સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ.

આભાર દર્શન :

બેંકના સુચારૂ અને કાર્યક્ષમ સંચાલનમાં મારા સહ-ડિરેક્ટરશ્રીઓ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોએ તેમની સમયસૂચિમાંથી કિંમતી સમય ફાળવીને, વહીવટી કામગીરી, વસુલાત તથા મહત્વની બેઠકોમાં સક્રિય હાજરી આપીને બેંકના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની દુરદર્શી દ્રષ્ટિ અને પ્રગતિશીલ વિચારો બેંક માટે માર્ગદર્શક બની રહ્યા છે. હું તેઓના સહયોગ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

સંસ્થાની સફળતામાં કર્મચારીઓ અને અધિકારીઓનું યોગદાન અનમોલ હોય છે. અમારા કર્મચારી દ્વારા ગ્રાહકોને ઝડપી, શ્રેષ્ઠ અને સન્માનપૂર્વક સેવા આપીને બેંકની પ્રતિષ્ઠા જનમાનસમાં ઉચ્ચ સ્તરે સ્થાપિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓના શ્રમ અને સમર્પણ માટે હું તેઓને હાર્દિક અભિનંદન પાઠવું છું.

ફેડરેશન, જીલ્લા તથા રાજ્યકક્ષાની સહકારી બેંકો, ઓડિટર્સ તથા અન્ય સહયોગી સંસ્થાઓ તરફથી મળતી સલાહ, માર્ગદર્શન અને સહયોગ અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. તેમની આ નિષ્ઠા અને સહભાગિતાની કિંમતી ભેટ માટે પણ હું ડિરેક્ટર મંડળ તરફથી હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

અમે એક આદર્શ સહકારી સંસ્થા તરીકે સમુદાય અને દેશની સેવા કરવા પ્રતિબદ્ધ છીએ. આધુનિક વિચારધારા, પારદર્શક સંચાલન અને પરિણામલક્ષી કામગીરીના માર્ગે આગળ વધતી આપણી બેન્કને સભાસદશ્રીઓ તથા ગ્રાહકો તરફથી મળતા અવિરત સહયોગ માટે ખુબ ખુબ આભાર...

આપ સૌનો સહકાર એ અમારી શક્તિ છે - અને વિકાસ એ અમારી પ્રતિબદ્ધતા છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી
જયેશભાઈ એન. ઘોળકીયા
ચેરમેન



ANNEXURE - E

INDEPENDENT AUDITOR'S REPORT

To,

The Members

SIHOR NAGARIK SAHAKARI BANK LIMITED.

SIHOR.

Report on Financial Statements

1. We have audited the Financial Statements of the **Sihor Nagarik Sahakari Bank Ltd.** ('The Bank') as at 31 March 2025 which comprise the Balance Sheet as at 31 March 2025, the Statement of Profit and Loss and Cash flow statement for the year then ended and as summary of significant accounting policies and other explanatory information. The returns of three branches audited by us are incorporated in these financial statements.

Management's Responsibilities for the Financial Statements

2. The Bank's management is responsible with respect to the preparation of these financial statements that give a true and fair view of the financial position and financial performance of the Bank in accordance with the accounting principles generally accepted in India, including the Accounting Standards issued by ICAI, and provisions of Section 29 of the Banking Regulation Act, 1949 and circulars and guidelines issued by the Reserve Bank of India ('RBI') and guidelines issued by the National Bank of Agricultural and Rural Development, The Registrar of Co-Operative Societies, Gujarat, The Gujarat Co-Operative Societies Act, 1961, and the Gujarat Co-Operative Societies Rules, 1965 and generally accepted accounting principles in India so far as applicable to bank. This responsibility also includes design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

Auditor's Responsibilities for the Audit of the Financial Statements

3. Our responsibility is to express an opinion on these financial statements based on our audit. We conducted our audit in accordance with standards on Auditing issued by the Institute of Chartered Accountants of India. Those standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatements.

4. An audit involves performing procedures to obtain audit evidence about the amounts and disclosures in the financial statements. The procedures selected depend on the auditor's judgement, including the assessment of the risks of material misstatements of the financial statements, whether due to fraud or error. In making those risk assessments, the auditor considers internal control relevant to the bank's preparation and fair presentation of the financial statements in order to design audit procedures that are appropriate of the entity's internal control. An audit also includes evaluating the appropriateness of accounting policies used and the reasonableness of the accounting estimates made by management, as well evaluating the overall presentation of the statements.

5. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion.



Basis for Opinion

6. In our opinion, except for the information referred to in the Basis for Qualified Opinion mentioned below and our General Audit Observations attached herewith forming part of report, and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements together with the notes thereon give the information required by the Banking Regulation Act, 1949, The Gujarat Co-Operative Societies Act, 1961 and guidelines issued by the National Bank of Agricultural and Rural Development, The Registrar of Co-Operative Societies, Gujarat in the manner so required for bank and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India:

- (a) In the case of Balance Sheet, of State of affairs of the Bank as at 31 March 2025
- (b) In the case of Profit and loss account, of the profit/loss for the year ended on that date: and
- (c) In the case of Cash Flow Statement, of the cash flows for the year ended on that date.

Basis for Qualified Opinion - NA

Report on Other Legal and Regulatory Requirements

- 7. The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in Forms "A" and "B" respectively of the third schedule to the Banking Regulation Act, 1949 and provisions of the The Gujarat Co-Operative Society Act, 1961 and Gujarat Co-Operative Societies Rules, 1965.
- 8. **We report that:**
 - a. We have obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of the audit and have found them to be satisfactory.
 - b. In our opinion, proper books of account as required by law have been kept by the Bank so far as it appears from our examination of those books and proper returns adequate for the purposes of our audit have been received from the branches/offices.
 - c. The transactions of the branch which have come to our notice have been within the powers of the Bank.
 - d. The Balance Sheet, and the Profit and Loss Account dealt with by this report are in agreement with the books of account;
 - e. The accounting standards adopted by the bank are consistent with those laid down by the accounting principles generally accepted in India so far as applicable to banks.
- 9. We further report that for the year under audit, the bank has been awarded "A" classification.

Place: Rajkot
Date: 05/06/2025

For, DSKHTP & Associates LLP

Chartered Accountants

CA Tejas Rupani

(Partner)

Membership No. 137309

FRN: 119285W/W100631

UDIN: 25137309BMIABW3322



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનું સરવૈયું					૩૧-૦૩-૨૦૨૫ ચાલુ વર્ષ	૩૧-૦૩-૨૦૨૪ પાછલું વર્ષ
ક્રમાંક	પેટા ક્રમાંક	મુડી તથા દેવા				
૧.	i.	૧.	શેર ભંડોળ :			
			અધિકૃત શેર ભંડોળ :			
			૩૧. ૧૦/- નો એક એવો ૫૦,૦૦,૦૦૦/- શેર્સ તે પૈકી			
			૧. અ વર્ગ ૩૧. ૧૦/- નો એક એવો ૨૦,૦૦,૦૦૦/- શેર્સ		૨,૦૦,૦૦,૦૦૦-૦૦	૧,૦૦,૦૦,૦૦૦-૦૦
			૨. બ વર્ગ ૩૧. ૧૦/- નો એક એવો ૩૦,૦૦,૦૦૦/- શેર્સ		૩,૦૦,૦૦,૦૦૦-૦૦	૨,૦૦,૦૦,૦૦૦-૦૦
					૫,૦૦,૦૦,૦૦૦-૦૦	૩,૦૦,૦૦,૦૦૦-૦૦
	ii.	૧.	ભરપાઈ થયેલ શેર ભંડોળ			
			અ વર્ગ ૩૧. ૧૦/- નો એક એવા ૧૦,૭૦,૯૫૨ શેર્સ (૩૧-૦૩-૨૫)		૧,૦૭,૦૯,૫૨૦-૦૦	૯૭,૫૭,૯૨૦-૦૦
			બ વર્ગ ૩૧. ૧૦/- નો એક એવા ૧૮,૯૩,૨૩૦ શેર્સ (૩૧-૦૩-૨૫)		૧,૮૯,૩૨,૩૦૦-૦૦	૧,૭૭,૬૦,૦૫૦-૦૦
		૨.	અ વર્ગ ૩૧. ૧૦/- નો એક એવા ૯,૭૫,૭૯૨ શેર્સ (૩૧-૦૩-૨૪)			
			બ વર્ગ ૩૧. ૧૦/- નો એક એવા ૧૭,૭૬,૦૦૫ શેર્સ (૩૧-૦૩-૨૪)			
			સરવાળો ૧		૨,૯૬,૪૧,૮૨૦-૦૦	૨,૭૫,૧૭,૯૭૦-૦૦
૨.	i.		રીઝર્વ ફંડ તથા અન્ય રીઝર્વર્સ :			
			અનામત ફંડ		૯,૧૧,૦૬,૦૩૪-૪૧	૮,૪૩,૫૯,૯૫૯-૪૧
	ii.		ખેતી વિષયક ક્રેડીટ સ્ટેબીલાઇઝેશન		૦-૦૦	૦-૦૦
	iii.		મકાન ફંડ		૩,૭૩,૩૨,૫૯૦-૨૩	૩૮,૦૦,૦૦૦-૦૦
	iv.		ડીવીડન્ડ ઇક્વીલાઇઝેશન ફંડ		૪,૦૦,૦૦૦-૦૦	૪,૦૦,૦૦૦-૦૦
	v.		બેડ ડેબ્ટ રીઝર્વ ફંડ		૦-૦૦	૪,૭૫,૩૦,૨૩૩-૦૦
	vi.	૧.	બેડ ડેબ્ટ ઇન્ટેરસ્ટ રીઝર્વ ફંડ		૦-૦૦	૧,૮૪,૩૦,૦૭૩-૩૬
	vi.	૨.	એન.પી.એ. પ્રોવીઝન્સ		૦-૦૦	૪,૩૯,૬૫,૯૪૨-૦૦
	vi.	૩.	B.D.D.R. ખાતે		૯,૧૫,૧૬,૬૩૩-૬૯	૦.૦૦
	vii.		ઇન્વેસ્ટમેન્ટ ઘસારા ફંડ ખાતે		૨,૭૩,૬૫૫.૦૦	૮૯,૫૮,૯૭૫-૦૦
	viii.		અન્ય ફંડ તથા રીઝર્વર્સ :			
		૧.	સ્ટાન્ડર્ડ એસેટ્સ પ્રોવિઝન્સ		૪૦,૦૦,૦૦૦-૦૦	૩૨,૦૦,૦૦૦-૦૦
		૨.	સમાજ કલ્યાણ ફંડ		૮,૭૪૦-૫૦	૮,૭૪૦-૫૦
		૩.	ધર્માદા ફંડ		૨,૬૨,૦૦૦-૦૦	૨,૬૨,૦૦૦-૦૦
		૪.	સ્ટાફ બેનિફિટ ફંડ		૫,૪૫,૦૫૨-૦૦	૩,૪૫,૦૫૨-૦૦
		૫.	બેંક ડેવલોપમેન્ટ ફંડ		૨,૦૦,૦૦૦-૦૦	૧,૦૦,૦૦૦-૦૦
		૬.	સભાસદ કલ્યાણ ફંડ		૮,૫૦,૩૦૪-૮૫	૬,૧૧,૭૩૪-૯૫
		૭.	મહોત્સવ ફંડ		૩,૮૩,૮૫૩-૩૪	૩,૮૩,૮૫૩-૩૪
		૮.	તબીબી સહાય ફંડ		૧,૧૦,૮૮૯-૧૮	૧,૧૦,૮૮૯-૧૮
		૯.	સ્ટાફ ગ્રેજ્યુઇટી ફંડ		૪,૨૦૦-૦૦	૪,૨૦૦-૦૦
		૧૦.	ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રીઝર્વ		૩,૮૩,૧૧,૨૦૦-૦૦	૩,૪૩,૧૧,૨૦૦-૦૦
		૧૧.	સ્ટાફ લીવ એન્કેશમેન્ટ પ્રોવિઝન		૬૯,૨૫,૦૦૦-૦૦	૬૯,૨૫,૦૦૦-૦૦
		૧૨.	આકસ્મિક જવાબદારી પ્રોવિઝન		૯૬,૦૫,૦૦૦-૦૦	૫૬,૦૫,૦૦૦-૦૦
		૧૩.	સભાસદ ભેટ ફંડ ખાતે		૪૩,૦૮૮-૦૦	૪૩,૦૮૮-૦૦
		૧૪.	ભા.ડી.કો. બેંક શેર પ્રોવિઝન		૧૬,૦૦૦-૦૦	૧૬,૦૦૦-૦૦
		૧૫.	સાચબર સિક્યુરીટી ફંડ		૨૦,૦૦,૦૦૦-૦૦	૧૦,૦૦,૦૦૦-૦૦
			સરવાળો ૨		૨૮,૩૮,૯૪,૨૪૧-૨૦	૨૬,૦૩,૭૧,૯૪૦-૭૪



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનું સરવૈયું					૩૧-૦૩-૨૦૨૫ ચાલુ વર્ષ	૩૧-૦૩-૨૦૨૪ પાછલું વર્ષ
ક્રમાંક	પેટા ક્રમાંક	મિલ્કત તથા લેણાં				
૧.	i.	અ. બ.	રોકડ : હાથ ઉપર રીઝર્વ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ અને સેન્ટ્રલ કો-ઓપ. બેંકોમાં ચાલુ ખાતામાં (Annexure-IV) ફિક્સ ડીપોઝીટ (Annexure-V)	સરવાળો ૧	૨,૧૭,૫૨,૦૦૦-૦૦	૧,૮૬,૦૬,૦૦૦-૦૦
	ii.				૨,૯૧,૨૫,૫૧૭-૧૪	૨,૯૨,૪૬,૮૫૧-૩૮
					૧૧,૯૫,૪૬,૫૫૪-૦૦	૯,૪૮,૬૨,૭૩૯-૦૦
					૧૭,૦૪,૨૪,૦૭૧-૧૪	૧૪,૨૭,૧૫,૫૯૦-૩૮
૨.	i.	અ. બ.	અન્ય બેંકોમાં બેલેન્સ : ચાલુ ખાતામાં (Annexure-VI) સેવિંગ્સ ખાતામાં ફિક્સ ડીપોઝીટ (Annexure-VII)	સરવાળો ૨	૨,૦૭,૯૮,૫૧૬-૨૫	૨,૨૪,૨૩,૫૨૬-૬૨
	ii.				૦-૦૦	૦-૦૦
	iii.				૬,૨૦,૦૦,૦૦૦-૦૦	૬,૭૦,૦૦,૦૦૦-૦૦
					૮,૨૭,૯૮,૫૧૬-૨૫	૮,૯૪,૨૩,૫૨૬-૬૨
૩.			ટૂંકી મુદત અને કોલ ડીપોઝીટ બેંકોમાં :		૦-૦૦	૦-૦૦
૪.	i.	અ. બ. ક.	રોકાણો સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટ સિક્યોરીટીમાં (બુક વેલ્યુ) ફેસ વેલ્યુ રૂ. ૬૮,૦૦,૦૦,૦૦૦-૦૦ માર્કેટ વેલ્યુ રૂ. ૬૮,૭૩,૪૪,૯૩૦-૦૦ બીજી ટ્રસ્ટી સિક્યોરીટીમાં સહકારી બેંકોમાં શેરમાં (Annexure-VIII)	સરવાળો ૪	૬૭,૨૦,૫૪,૭૫૦-૦૦	૬૭,૨૦,૫૪,૭૫૦-૦૦
	ii.				૦-૦૦	૦-૦૦
	iii.				૯,૨૧,૦૦૦-૦૦	૯,૨૧,૦૦૦-૦૦
					૬૭,૨૯,૭૫,૭૫૦-૦૦	૬૭,૨૯,૭૫,૭૫૦-૦૦
૫.			પ્રિન્સીપાલ-સબસીડીયરી સ્ટેટ પાર્ટનરશીપ ફંડમાં રોકાણો		૦-૦૦	૦-૦૦
૬.	i.	અ. બ. ક.	ધીરાણો : ટૂંકી મુદત લોન : સી.સી. ઓ.ડી. એન્ડ બીલ્સ ડિસ્કાઉન્ટેડ જે પૈકી સિક્યોર્ડ અગેઈનસ્ટ સરકારી અને અન્ય માન્ય જામીનગીરી અન્ય વાસ્તવિક સિક્યુરીટી અનસિક્યોર્ડ ધિરાણ	સરવાળો ૬ (i)	૦-૦૦	૦-૦૦
					૨૯,૩૬,૫૭,૪૦૦-૫૬	૨૫,૨૪,૮૨,૩૮૫-૪૫
					૪૪,૨૯૫-૧૭	૪૪,૬૨૦-૧૭
					૨૯,૩૭,૦૧,૬૯૫-૭૩	૨૫,૨૫,૨૭,૦૦૫-૬૨
		અ. બ. ક.	ઉપરોક્ત ધિરાણ પૈકી વ્યક્તિગત ધિરાણ મુદત વિતેલ રકમ ખરાબ અને શકમંદ લેણાની રકમ		૨૯,૩૭,૦૧,૬૯૫-૭૩	૨૫,૨૫,૨૭,૦૦૫-૬૨
					૨,૫૫,૭૦,૪૦૧-૪૮	૨,૭૧,૭૯,૮૭૦-૮૧
					૧,૬૯,૬૮,૪૮૯-૯૮	૧,૯૩,૭૯,૨૦૬-૮૧
					૨,૨૧,૭૫,૬૩૩-૧૨	૨,૧૮,૮૭,૩૯૪-૧૨
	ii.	અ. બ. ક.	મધ્યમ મુદત લોન જે પૈકી સિક્યોર્ડ અગેઈનસ્ટ સરકારી અને અન્ય માન્ય જામીનગીરી અન્ય વાસ્તવિક સિક્યુરીટી અનસિક્યોર્ડ ધિરાણ	સરવાળો ૬ (ii)	૨,૮૭,૬૦૨-૦૦	૭૬,૩૮૬-૦૦
					૬૩,૮૧,૭૩૦-૮૮	૬૭,૦૪,૪૬૨-૮૮
					૧,૫૫,૦૬,૩૦૦-૨૪	૧,૫૧,૦૬,૫૪૫-૨૪
					૨,૨૧,૭૫,૬૩૩-૧૨	૨,૧૮,૮૭,૩૯૪-૧૨
		અ. બ. ક.	ઉપરોક્ત ધિરાણ પૈકી વ્યક્તિગત ધિરાણ મુદત વિતેલ રકમ ખરાબ અને શકમંદ લેણાની રકમ		૨,૨૧,૭૫,૬૩૩-૧૨	૨,૧૮,૮૭,૩૯૪-૧૨
					૯૯,૫૯,૫૮૭-૧૨	૧,૦૦,૯૧,૭૩૮-૧૨
					૧,૦૨,૬૪,૫૦૭-૧૨	૧,૦૫,૬૨,૦૨૮-૧૨



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનું સરવૈયું					૩૧-૦૩-૨૦૨૫ ચાલુ વર્ષ	૩૧-૦૩-૨૦૨૪ પાછલું વર્ષ
ક્રમાંક	પેટા ક્રમાંક	મુડી તથા દેવા				
૩.		પ્રિન્સીપાલ-સબસીડીયરી સ્ટેટ-પાર્ટનરશીપ ફંડ :			૦-૦૦	૦-૦૦
	i.	સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકો			૦-૦૦	૦-૦૦
	ii.	પ્રાથમિક ખેતી વિષયક સહકારી મંડળી			૦-૦૦	૦-૦૦
	iii.	અન્ય સોસાયટી			૦-૦૦	૦-૦૦
૪.		થાપણો :				
	i.	ફિક્સ ડીપોઝીટ :				
	અ.	વ્યક્તિગત (Annexure-I)			૧,૧૧,૯૯,૧૫,૫૭૧-૦૦	૯૬,૭૮,૩૬,૮૪૧-૦૦
	બ.	સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકો			૦-૦૦	૦-૦૦
	ક.	અન્ય સોસાયટી			૦-૦૦	૦-૦૦
		સરવાળો ૪ (i)			૧,૧૧,૯૯,૧૫,૫૭૧-૦૦	૯૬,૭૮,૩૬,૮૪૧-૦૦
	ii.	સેવીંગ્સ ડીપોઝીટ :				
	અ.	વ્યક્તિગત (Annexure-II)			૨૧,૭૧,૧૮,૨૫૫-૬૧	૨૩,૨૦,૬૧,૨૯૭-૧૨
	બ.	સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકો			૦-૦૦	૦-૦૦
	ક.	અન્ય સોસાયટી			૦-૦૦	૦-૦૦
		સરવાળો ૪ (ii)			૨૧,૭૧,૧૮,૨૫૫-૬૧	૨૩,૨૦,૬૧,૨૯૭-૧૨
	iii.	કરંટ ડીપોઝીટ :				
	અ.	વ્યક્તિગત (Annexure-III)			૧૬,૩૧,૯૨,૮૦૩-૩૧	૧૮,૬૦,૧૨,૦૧૮-૬૨
	બ.	સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકો			૦-૦૦	૦-૦૦
	ક.	અન્ય સોસાયટી			૦-૦૦	૦-૦૦
		સરવાળો ૪ (iii)			૧૬,૩૧,૯૨,૮૦૩-૩૧	૧૮,૬૦,૧૨,૦૧૮-૬૨
	iv.	કોલ ડીપોઝીટ :				
		સરવાળો ૪ (i+ii+iii+iv)			૦-૦૦	૦-૦૦
		૧,૫૦,૦૨,૨૬,૬૨૯-૯૨			૧,૩૮,૫૯,૧૦,૧૫૬-૭૪	
૫.		કરજ :				
	i.	રીઝર્વ બેંક, સ્ટેટ-સેન્ટ્રલ કો-ઓપ. બેંકોમાંથી			૦-૦૦	૦-૦૦
	ii.	સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને નોટીફાઇડ બેંકોમાંથી			૦-૦૦	૦-૦૦
	iii.	રાજ્ય સરકારશ્રી પાસેથી			૦-૦૦	૦-૦૦
	iv.	અન્ય			૦-૦૦	૦-૦૦
		સરવાળો ૫ (i+ii+iii+iv)			૦-૦૦	૦-૦૦
૬.		બિલ્સ ફોર કલેક્શન : (Contra.)			૦-૦૦	૦-૦૦
૭.		બ્રાન્ચ એડજસ્ટમેન્ટ :			૦-૦૦	૦-૦૦
૮.		ઓવરડ્રયુ ઈન્ટરેસ્ટ રિઝર્વ :				
	i.	ઓવરડ્રયુ ઈન્ટરેસ્ટ રિઝર્વ			૦-૦૦	૩,૬૩,૯૨૬-૬૫
	ii.	ઓવરડ્રયુ ઈન્ટરેસ્ટ રિઝર્વ (એન.પી.એ.) Contra.			૧૧,૬૮,૧૫,૩૪૮-૩૪	૧૨,૨૩,૫૯,૬૨૭-૩૪
		સરવાળો ૮			૧૧,૬૮,૧૫,૩૪૮-૩૪	૧૨,૨૭,૨૩,૫૫૩-૯૯
૯.		વ્યાજ દેવા ખાતે :			૭,૬૬,૮૯,૧૫૨-૧૬	૭,૨૪,૧૫,૯૮૩-૧૬



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનું સરવૈયું

ક્રમાંક	પેટા ક્રમાંક	મિલકત તથા લેણાં	૩૧-૦૩-૨૦૨૫ ચાલુ વર્ષ	૩૧-૦૩-૨૦૨૪ પાછલું વર્ષ
૭.	iii.	લાંબી મુદત લોન જે પૈકી સિક્યોર્ડ અગેઈનસ્ટ અ. સરકારી અને અન્ય માન્ય જામીનગીરી બ. અન્ય વાસ્તવિક સિક્યુરીટી ક. અનસિક્યોર્ડ ધિરાણ સરવાળો ૬ (iii)	0-00 ૬૪,૨૧,૯૫,૫૨૪-૨૨ 0-00 ૬૪,૨૧,૯૫,૫૨૪-૨૨	0-00 ૫૬,૬૮,૫૬,૭૯૩-૨૨ 0-00 ૫૬,૬૮,૫૬,૭૯૩-૨૨
		ઉપરોક્ત ધિરાણ પૈકી અ. વ્યક્તિગત ધિરાણ બ. મુદત વિતેલ રકમ ક. ખરાબ અને શકમંદ લેણાની રકમ સરવાળો ૬ (i+ii+iii)	૬૪,૨૧,૯૫,૫૨૪-૨૨ ૧,૨૮,૪૩,૪૧૭-૨૨ ૪,૮૨,૩૪,૪૭૩-૨૨ ૯૫,૮૦,૭૨,૮૫૩-૦૭	૫૬,૬૮,૫૬,૭૯૩-૨૨ ૧,૨૫,૦૦,૮૮૯-૨૨ ૪,૫૮,૬૯,૯૨૮-૨૨ ૮૪,૧૨,૭૧,૧૯૨-૯૬
	i.	વ્યાજ લેણાં ખાતે અન્ય બેંકની ફિક્સ ડીપોઝીટ પરનું વ્યાજ	૬૬,૮૮,૬૨૩-૦૦	૭૪,૫૨,૪૨૭-૦૦
	ii.	ગવર્નમેન્ટ સિક્યુરીટીનું વ્યાજ	૯૭,૦૨,૧૯૩-૦૦	૯૭,૦૨,૧૯૩-૦૦
	iii.	ઓવરડ્રયુ ઇન્ટરેસ્ટ રીસીવેબલ (એન.પી.એ.) (Contra.) સરવાળો ૭ (i+ii+iii)	૧૧,૬૮,૧૫,૩૪૮-૩૪ ૧૩,૩૨,૦૬,૧૬૪-૩૪	૧૨,૨૩,૫૯,૬૨૭-૩૪ ૧૩,૯૫,૧૪,૨૪૭-૩૪
		જે પૈકી મુદત વિતેલ ખરાબ અને શકમંદ લેણાની રકમ	૧૧,૬૮,૧૫,૩૪૮-૩૪ ૧૧,૬૮,૧૫,૩૪૮-૩૪	૧૨,૨૩,૫૯,૬૨૭-૩૪ ૧૨,૨૩,૫૯,૬૨૭-૩૪
	૮.	બિલ્સ રીસીવેબલ : (Contra.)	0-00	0-00
	૯.	બ્રાંચ એડજસ્ટમેન્ટ :	0-00	0-00
	૧૦.	સ્થાવર મિલકત : (Annexure-IX)	૧,૦૧,૭૪,૭૧૩-૦૦	૮,૫૮,૦૧૪-૦૦
	૧૧.	ફર્નીચર ફીક્ચર્સ : (Annexure-X)	૧૧,૩૪,૩૯૬-૦૦	૨૧,૨૪,૧૯૫-૦૦
	૧૨.	બીજી મિલકત :		
	૧.	સ્પે. એડહેસિવ સ્ટેમ્પ	૬૫,૪૦૦-૦૦	૪૨,૦૦૦-૦૦
	૨.	પગાર એડવાન્સ ખાતે	૧,૬૫,૦૦૦-૦૦	૧,૭૫,૦૦૦-૦૦
	૩.	સ્ટેમ્પ ફ્રેન્ડીંગ એકાઉન્ટ ખાતે	0-00	૪,૩૮,૪૧૬-૦૦
	૪.	ઈન્કમેટેક્સ એડવાન્સ ખાતે	૧,૧૦,૦૦,૦૦૦-૦૦	૧,૦૫,૦૦,૦૦૦-૦૦
	૫.	CGST રીસીવેબલ ખાતે	૭,૩૬,૨૭૨-૯૬	૬,૦૩,૨૮૩-૩૮
	૬.	SGST રીસીવેબલ ખાતે	૬,૨૬,૫૨૫-૯૬	૫,૧૦,૧૨૪-૩૮
	૭.	IGST રીસીવેબલ ખાતે	0-00	૭૯૦-૯૮
	૮.	ઈન્કમેટેક્સ રીફંડ રીસીવેબલ	૮,૧૬,૧૭૦-૦૦	૮,૧૬,૧૭૦-૦૦
	૯.	સન્ડ્રી ડેબ્ટર્સ ખાતે	૩,૦૦૦-૦૦	0-00
		સરવાળો ૧૨	૧,૩૪,૧૨,૩૬૮-૯૨	૧,૩૦,૮૫,૭૮૪-૭૪



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનું સરવૈયું					૩૧-૦૩-૨૦૨૫ ચાલુ વર્ષ	૩૧-૦૩-૨૦૨૪ પાછલું વર્ષ
ક્રમાંક	પેટા ક્રમાંક	મુડી તથા દેવા				
૧૦.	i. ii.	અન્ય જવાબદારીઓ :				
		બીલ્સ પેએબલ ખાતે			૫૭,૩૭૮-૦૦	૫૮,૨૩૫-૦૦
		ચુકવવા પાત્ર ડીવીડન્ડ				
		a. ડીવીડન્ડ પેએબલ (૨૦૨૦-૨૧) ખાતે			૦-૦૦	૨,૬૫,૧૯૪-૦૦
		b. ડીવીડન્ડ પેએબલ (૨૦૨૧-૨૨) ખાતે			૩,૧૦,૫૬૯-૦૦	૩,૧૩,૭૦૨-૦૦
	a. b. c. d.	ડીવીડન્ડ પેએબલ (૨૦૨૨-૨૩) ખાતે			૩,૧૧,૨૪૭-૦૦	૩,૨૧,૦૫૧-૦૦
		ડીવીડન્ડ પેએબલ (૨૦૨૩-૨૪) ખાતે			૨,૮૭,૫૮૩.૦૦	૦-૦૦
		સરવાળો ૧૦ (ii)			૯,૦૬,૩૬૯-૦૦	૮,૯૯,૯૪૭-૦૦
	iii. iv.	સસ્પેન્ડ			૦-૦૦	૦-૦૦
		સન્ડ્રી				
		૧. શેર અનામત ખાતે			૧,૬૭,૫૦૧-૦૦	૩,૫૦,૦૦૧-૦૦
		૨. સ્ટાફ અધર ફંડ ખાતે			૬૩,૯૮૩-૦૦	૧,૫૧,૪૫૨-૦૦
		૩. ઈન્સ્યુરન્સ પેએબલ ખાતે (ગોલ્ડ લોન)			૫,૨૫,૭૮૪-૦૦	૩,૭૫,૬૬૨-૦૦
		૪. ઈન્કમેટેક્સ પ્રોવિઝન સને ૨૦૨૩-૨૪			૦-૦૦	૧,૦૫,૦૦,૦૦૦-૦૦
		૫. ઈન્કમેટેક્સ પ્રોવિઝન સને ૨૦૨૩-૨૪			૧,૧૦,૦૦,૦૦૦-૦૦	૦-૦૦
		૬. સ્ટાફ બોનસ પેએબલ ખાતે			૧૨,૨૩,૬૬૭-૦૦	૧૨,૧૧,૦૩૩-૦૦
		૭. ઈન્કમેટેક્સ રીફંડ રીસીવેબલ પ્રોવિઝન ખાતે			૮,૧૬,૧૭૦-૦૦	૮,૧૬,૧૭૦-૦૦
		૮. ટેક્સ પેએબલ ખાતે			૪,૨૩,૮૭૪.૦૦	૨,૫૨,૫૩૭.૦૦
		૯. સ્ટાફ ઈન્કમેટેક્સ કપાત ખાતે			૫,૦૦૦.૦૦	૨૦,૦૦૦.૦૦
		સરવાળો ૧૦ (iv)			૧,૪૨,૨૫,૯૭૯-૦૦	૧,૩૬,૭૬,૮૫૫-૦૦
		સરવાળો ૧૦ (i+ii+iii+iv)			૧,૫૧,૯૨,૭૫૬-૦૦	૧,૪૬,૩૫,૦૩૭-૦૦
૧૧.	૧.	નફા-તોટા ખાતું :				
		ગત સાલનો નફો			૧,૮૩,૯૩,૬૫૯-૪૧	૧,૬૯,૮૧,૭૨૦-૦૩
		બાદ - ફાળવણી કરતાં			૧,૮૩,૯૩,૬૫૯-૪૧	૧,૬૯,૮૧,૭૨૦-૦૩
		ઉમેરો - ચાલુ સાલનો નફો, નફા-નુકશાન ખાતેથી			૧,૯૭,૩૮,૮૮૫-૧૦	૧,૮૩,૯૩,૬૫૯-૪૧
		સરવાળો ૧૧			૧,૯૭,૩૮,૮૮૫-૧૦	૧,૮૩,૯૩,૬૫૯-૪૧
	૧.	કુલ સરવાળો			૨,૦૪,૨૧,૯૮,૮૩૨-૭૨	૧,૯૦,૧૯,૬૮,૩૦૧-૦૪
		આકસ્મિક જવાબદારીઓ :				
		આપેલ જામીનગીરી માટેની બહારી જવાબદારી			૦-૦૦	૦-૦૦
		અન્ય				
		ડીપોઝીટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ-૨૦૧૪ (Annexure-XI)			૬૧,૭૯,૨૮૪-૮૦	૫૮,૩૯,૬૧૭-૪૧
	i. ii.	આકસ્મિક જવાબદારીઓનો સરવાળો			૬૧,૭૯,૨૮૪-૮૦	૫૮,૩૯,૬૧૭-૪૧

આજ તારીખનાં અમારા જુદા રીપોર્ટ મુજબ

ફોર, DSKHTP & Associates LLP

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

સીએ તેજસ રૂપાણી

FRN - 119285W/W100631 M. No. 137309

તા. ૦૫-૦૬-૨૦૨૫

UDIN : 25137309BMIABW3322

અલ્પેશભાઈ કે. શેઠ

બ્રાંચ મેનેજર

પ્રકાશભાઈ બી. મકવાણી

બ્રાંચ મેનેજર



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનું સરવૈયું

ક્રમાંક	પેટા ક્રમાંક	મિલ્કત તથા લેણાં	૩૧-૦૩-૨૦૨૫ ચાલુ વર્ષ	૩૧-૦૩-૨૦૨૪ પાછલું વર્ષ
૧૩.		દાવા પેટે પ્રાપ્ત કરેલ નોન બેંકીંગ અકસ્થાપતો :	૦-૦૦	૦-૦૦
૧૪.		નફા-તોટા ખાતું :	૦-૦૦	૦-૦૦
કુલ સરવાળો			૨,૦૪,૨૧,૯૮,૮૩૨-૭૨	૧,૯૦,૧૯,૬૮,૩૦૧-૦૪

વામનભાઈ જે. મહેતા
જનરલ મેનેજર

ધીરૂભાઈ એન. વાળા
મેનેજર

જયેશભાઈ એન. ઘોળકીયા
ચેરમેન

: ડિરેક્ટરશ્રીઓ :

અશ્વિનભાઈ સી. ગોરડીયા
રાજેન્દ્રકુમાર ડી. જાની
ધીરેન્દ્રકુમાર કે. મહેતા
મહેન્દ્રભાઈ એન. મણીયાર

શરદભાઈ એન. ગોરડીયા
ધનસુખભાઈ ડી. રાઠોડ
યોગેશભાઈ આર. મહેતા
પ્રકાશભાઈ એમ. મહેતા

પ્રકાશભાઈ એન. સલોત
પંકજભાઈ વી. જાની
અશોકભાઈ એસ. મુની

ભાવનાબેન પી. કળથીયા
મીનાક્ષીબેન એમ. દવે
શૌલેષભાઈ જે. દવે
(કો-ઓપ્. પ્રો. ડિરેક્ટર)



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “મુડી તથા દેવા” માં આઈટમ નં. ૪(૧) (અ) ફિક્સ ડીપોઝીટની વિગત (Annexure-I)

ડીપોઝીટની વિગત	૩૧-૦૩-૨૦૨૫	૩૧-૦૩-૨૦૨૪
(૧) બાંધી મુદત થાપણ	૨૭,૫૬,૯૯,૦૭૫-૦૦	૨૧,૩૪,૪૮,૭૬૮-૦૦
(૨) કુબેર ફીક્સ થાપણ	૮૩,૭૪,૫૩,૧૩૬-૦૦	૭૪,૮૬,૧૯,૫૧૩-૦૦
(૩) રીકર્ડિંગ થાપણ	૬૪,૬૩,૩૬૦-૦૦	૫૭,૬૮,૫૬૦-૦૦
કુલ સરવાળો	૧,૧૧,૯૬,૧૫,૫૭૧-૦૦	૯૬,૭૮,૩૬,૮૪૧-૦૦

તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “મુડી તથા દેવા” માં આઈટમ નં. ૪(૨) (અ) સેવિંગ્સ ડીપોઝીટની વિગત (Annexure-II)

ડીપોઝીટની વિગત	૩૧-૦૩-૨૦૨૫	૩૧-૦૩-૨૦૨૪
(૧) બચત થાપણ	૨૧,૬૯,૦૦,૯૧૫-૫૦	૨૩,૧૭,૪૬,૬૬૧-૫૦
(૨) સ્પેશ્યલ બચત થાપણ	૨,૧૭,૩૪૦-૨૨	૩,૧૪,૬૩૫-૬૨
કુલ સરવાળો	૨૧,૭૧,૧૮,૨૫૫-૬૧	૨૩,૨૦,૬૧,૨૯૭-૧૨

તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “મુડી તથા દેવા” માં આઈટમ નં. ૪(૩) (અ) કરંટ ડીપોઝીટની વિગત (Annexure-III)

ડીપોઝીટની વિગત	૩૧-૦૩-૨૦૨૫	૩૧-૦૩-૨૦૨૪
(૧) કરંટ ડીપોઝીટ	૧,૧૮,૨૨,૦૯૪-૩૫	૧,૫૧,૯૦,૬૭૪-૬૧
(૨) મેચ્યોર્ડ ફીક્સ ડીપોઝીટ	૨,૮૯,૫૧,૦૯૧-૦૦	૪,૨૧,૭૨,૮૩૩-૫૯
(૩) મેચ્યોર્ડ કુબેર ફીક્સ ડીપોઝીટ	૧૨,૧૯,૨૪,૧૪૭-૦૦	૧૨,૭૩,૦૮,૭૧૫-૦૦
(૪) સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ ધીરાણનું જમા બેલેન્સ	૩૭-૫૦	૦-૦૦
(૫) સ્ટાફ ઓવર ડ્રાફ્ટ ધીરાણનું જમા બેલેન્સ	૫૪,૨૧૫-૮૦	૧૧,૯૪,૧૨૯-૧૩
(૬) ફીક્સ સામે ઓવર ડ્રાફ્ટ ધીરાણનું જમા બેલેન્સ	૪,૪૧,૨૧૭-૬૬	૧,૩૭,૮૧૮-૬૬
(૭) હાઇપોથેકિશન ધીરાણ ખાતાઓનું જમા બેલેન્સ	૦-૦૦	૭,૮૪૭-૬૩
કુલ સરવાળો	૧૬,૩૧,૯૨,૮૦૩-૩૧	૧૮,૬૦,૧૨,૦૧૮-૬૨

તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “મિલકત તથા લેણાં” માં આઈટમ નં. ૧ (ii) (અ) (Annexure-IV)

“રીઝર્વ બેંક, એસ.બી.આઈ., સ્ટેટ અને સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકોમાં” ચાલુ ખાતામાં બેલેન્સની વિગત

બેન્કનું નામ	૩૧-૦૩-૨૦૨૫	૩૧-૦૩-૨૦૨૪
(૧) ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લિ.,	૨૪,૨૮,૪૧૫-૮૭	૧,૩૧,૬૨,૫૫૧-૧૧
(૨) ધી ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક લિ.,	૬૮,૬૮,૯૨૨-૮૪	૫૩,૭૬,૭૦૫-૮૪
(૩) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા	૧,૯૮,૨૮,૧૭૮-૪૩	૧,૦૭,૦૭,૫૯૪-૪૩
કુલ સરવાળો	૨,૯૧,૨૫,૫૧૭-૧૪	૨,૯૨,૪૬,૮૫૧-૩૮

તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “મિલકત તથા લેણાં” માં આઈટમ નં. ૧ (ii) (બ) (Annexure-V)

“રીઝર્વ બેંક, એસ.બી.આઈ., સ્ટેટ અને સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકોમાં” ફીક્સ ડીપોઝીટની વિગત

બેન્કનું નામ	૩૧-૦૩-૨૦૨૫	૩૧-૦૩-૨૦૨૪
(૧) ધી ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક લિ.,	૫,૧૦,૦૦,૦૦૦-૦૦	૩,૭૦,૦૦,૦૦૦-૦૦
(૨) ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લિ., (એમ.એ. સ્કીમ)	૦-૦૦	૪,૦૦,૦૦૦-૦૦
(૩) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા	૨,૬૬,૨૧,૫૫૪-૦૦	૧,૫૫,૩૭,૭૩૯-૦૦
(૪) ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લિ.,	૩,૫૦,૦૦,૦૦૦-૦૦	૩,૫૦,૦૦,૦૦૦-૦૦
(૫) ધી ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક લિ., (સ્ટાફ લીવ એનકેશમેન્ટ ફી.ડી)	૬૯,૨૫,૦૦૦-૦૦	૬૯,૨૫,૦૦૦-૦૦
કુલ સરવાળો	૧૧,૯૫,૪૬,૫૫૪-૦૦	૯,૪૮,૬૨,૭૩૯-૦૦

તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “મિલકત તથા લેણાં” માં આઈટમ નં. ૨ (i) અન્ય બેંકોમાં બેલેન્સ “ચાલુ ખાતામાં” ની વિગત (Annexure-VI)

બેન્કનું નામ	૩૧-૦૩-૨૦૨૫	૩૧-૦૩-૨૦૨૪
(૧) બેન્ક ઓફ ઈન્ડિયા	૫,૬૬,૩૨૮-૨૬	૬,૮૫,૩૨૮-૨૬
(૨) એચ.ડી.એફ.સી. બેંક લિ.	૪૮,૭૨,૧૩૦-૬૭	૪૩,૫૯,૬૭૦-૪૬
(૩) આઈ.ડી.બી.આઈ. બેંક લિ.	૧,૫૩,૬૦,૦૫૭-૩૨	૧,૭૩,૭૮,૫૨૭-૯૦
કુલ સરવાળો	૨,૦૭,૯૮,૫૧૬-૨૫	૨,૨૪,૨૩,૫૨૬-૬૨



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “મિલકત તથા લેણાં” માં આઈટમ નં. ૨ (iii) અન્ય બેંકોમાં બેલેન્સ “ફીક્સ ડીપોઝીટ” ની વિગત (Annexure-VII)

બેન્કનું નામ	૩૧-૦૩-૨૦૨૫	૩૧-૦૩-૨૦૨૪
(૧) સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક	૩,૫૦,૦૦,૦૦૦-૦૦	૬,૦૦,૦૦,૦૦૦-૦૦
(૨) એચ. ડી.એફ.સી. બેન્ક	૨૦,૦૦,૦૦૦-૦૦	૨૦,૦૦,૦૦૦-૦૦
(૩) પંજાબ એન્ડ સિંધ બેન્ક	૫૦,૦૦,૦૦૦-૦૦	૫૦,૦૦,૦૦૦-૦૦
(૪) આઈ.ડી.બી.આઈ. બેન્ક લિ.	૨,૦૦,૦૦,૦૦-૦૦	૦-૦૦
કુલ સરવાળો	૬,૨૦,૦૦,૦૦૦-૦૦	૬,૭૦,૦૦,૦૦૦-૦૦

તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “મિલકત તથા લેણાં”માં આઈટમ નં. ૪ “રોકાણો”ની વિગત (Annexure-VIII)

રોકાણોની વિગત	૩૧-૦૩-૨૦૨૫	૩૧-૦૩-૨૦૨૪
અ. સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટ સીક્યોરીટીમાં :		
(૧) ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા રોકાણ		
૧. અવેલેબલ ફોર સેલ ખાતે	૬૧,૬૩,૮૦,૨૫૦-૦૦	૬૧,૬૩,૮૦,૨૫૦-૦૦
૨. હેલ્ડ ટુ મેચ્યોરીટી ખાતે	૫,૫૬,૭૪,૫૦૦-૦૦	૫,૫૬,૭૪,૫૦૦-૦૦
કુલ સરવાળો	૬૭,૨૦,૫૪,૭૫૦-૦૦	૬૭,૨૦,૫૪,૭૫૦-૦૦
બ. સહકારી બેન્કોનાં શેરમાં :		
(૧) ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લિ.,	૯,૦૫,૦૦૦-૦૦	૯,૦૫,૦૦૦-૦૦
(૨) ધી ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક લિ.	૧૬,૦૦૦-૦૦	૧૬,૦૦૦-૦૦
કુલ સરવાળો	૯,૨૧,૦૦૦-૦૦	૯,૨૧,૦૦૦-૦૦

તા. ૩૧-૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “મિલકત તથા લેણાં” માં આઈટમ નં. ૧૦ “સ્થાવર મિલકત”ની વિગત (Annexure-IX)

વિગત	ઉદ્ધતી બાકી	બાદ : ઘસારો	બાદ-વેચાણ	ઉમેરો નવી ખરીદી	નેટ બેલેન્સ
મકાન ખાતે	૮,૫૮,૦૧૪-૦૦	૮૫,૮૦૧-૦૦	+	૦-૦૦	૮૪,૦૨,૫૦૦-૦૦
					૧,૦૧,૭૪,૭૧૩-૦૦

તા. ૩૧-૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “મિલકત તથા લેણાં”માં આઈટમ નં. ૧૧ “ફર્નિચર ફીક્સર્સ”ની વિગત (Annexure-X)

વિગત	ઉદ્ધતી બાકી	બાદ : ઘસારો	બાદ-વેચાણ	ઉમેરો : નવી ખરીદી	નેટ બેલેન્સ
ફર્નિચર ફીક્સર્સ	૨,૨૬,૦૫૭-૦૦	૨૨,૬૦૬-૦૦	૦-૦૦	૦-૦૦	૨,૦૩,૪૫૧-૦૦
સેઈફ ડીપોઝીટ વોલ્ટ	૫,૮૦,૫૦૫-૦૦	૮૭,૦૭૪-૦૦	૦-૦૦	૦-૦૦	૪,૯૩,૪૩૧-૦૦
કોમ્પ્યુટર ખાતે	૧,૮૨,૩૨૬-૦૦	૯૩,૨૪૫-૦૦	૦-૦૦	૦-૦૦	૮૯,૦૮૧-૦૦
ફ્રેન્ટિંગ મશીન	૬,૯૧,૬૮૭-૦૦	૦-૦૦	૬,૯૧,૬૮૭-૦૦	૦-૦૦	૦-૦૦
એરકન્ડીશન ખાતે	૩,૨૯,૦૩૭-૦૦	૪૯,૩૫૪-૦૦	૦-૦૦	૦-૦૦	૨,૭૯,૬૮૩-૦૦
સોફ્ટવેર ખાતે	૧,૧૪,૫૮૩-૦૦	૪૫,૮૩૩-૦૦	૦-૦૦	૦-૦૦	૬૮,૭૫૦-૦૦
કુલ	૨૧,૨૪,૧૯૫-૦૦				૧૧,૩૪,૩૯૬-૦૦

તા. ૩૧-૩-૨૦૨૫નાં રોજનાં સરવૈયામાં “આકસ્મિક જવાબદારીઓ” માં આઈટમ નં. ૧૩ “ડોરમેન્ટ ડીપોઝીટ (DEAF)” ની વિગત (Annexure-XI)

ડોરમેન્ટ ડીપોઝીટ (DEAF)ની વિગત	૩૧-૦૩-૨૦૨૫	૩૧-૦૩-૨૦૨૪
(૧) ફીક્સ ડીપોઝીટ	૨,૮૧,૨૩૫-૫૦	૨,૮૧,૨૩૫-૫૦
(૨) સેવિંગ્સ ડીપોઝીટ	૪૯,૮૨,૨૦૨-૨૦	૪૬,૫૩,૧૩૬-૮૧
(૩) કરંટ ડીપોઝીટ	૨,૧૦,૪૬૧-૮૬	૨,૧૦,૪૬૧-૮૬
(૪) કુબેર ફીક્સ ડીપોઝીટ	૩,૦૯,૩૦૩-૦૦	૨,૯૯,૬૭૫-૦૦
(૫) સ્પેશ્યલ સેવિંગ્સ ડીપોઝીટ	૨૪,૬૩૧-૬૪	૨૪,૬૩૧-૬૪
(૬) રીકર્ડિંગ ડીપોઝીટ	૧,૧૮,૯૮૨-૦૦	૧,૧૮,૦૦૮-૦૦
(૭) ટ્રસ્ટ સેવિંગ્સ ડીપોઝીટ	૧૬,૯૨૪-૩૩	૧૬,૯૨૪-૩૩
(૮) ફરજિયાત બચત ડીપોઝીટ	૨,૩૪,૯૨૬-૨૮	૨,૩૪,૯૨૬-૨૮
(૯) સ્ટાફ સેવિંગ્સ ડીપોઝીટ	૬૧૭-૯૯	૬૧૭-૯૯
કુલ સરવાળો	૬૧,૭૯,૨૮૪-૮૦	૫૮,૩૯,૬૧૭-૪૧



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું					
૩૧-૦૩-૨૦૨૪	ક્રમાંક	પેટા ક્રમાંક	અર્થ		૩૧-૦૩-૨૦૨૫
૧૨,૮૩,૮૧,૫૨૭-૨૪	૧.		શ્રી ચુકવેલ વ્યાજ થાપણ, કરજ વિગેરે ઉપર :		૧૭,૭૬,૭૯,૮૧૫-૮૮
૨,૦૮,૯૩,૩૭૨-૦૦	૨.	i.	શ્રી પગાર એલાઉન્સ તથા પ્રોવિડન્ટ ફંડ :	૧,૯૮,૪૪,૯૩૭-૦૦	
૧૨,૦૦,૦૦૦-૦૦		ii.	શ્રી સ્ટાફ ગ્રેયુદ્ધટી અર્થ	૧૨,૦૦,૦૦૦-૦૦	
૧૨,૭૦,૨૮૯-૦૦		iii.	શ્રી મેડીકલ એલાઉન્સ	૧૨,૭૨,૪૫૩-૦૦	
૭૦,૮૨૨-૦૦		iv.	શ્રી સ્ટાફ પ્રો. ફંડ ઓર્ગેનાઇઝેશન સર્વિસ ચાર્જ	૭૦,૭૩૨-૦૦	
૪૪,૧૬૭-૦૦		v.	શ્રી સ્ટાફ પી.એફ. ડી.એલ.આઈ. અર્થ ખાતે	૪૨,૯૮૫-૦૦	
૧૨,૧૧,૦૩૩-૦૦		vi.	શ્રી સ્ટાફ બોનસ અર્થ ખાતે	૧૨,૨૩,૬૬૭-૦૦	
૧,૧૧,૫૩૨-૩૦		vii.	શ્રી સ્ટાફ યુનિફોર્મ અર્થ ખાતે	૧,૩૮,૧૪૪-૭૨	
૧,૩૭,૮૭૬-૦૦		viii.	શ્રી સ્ટાફ લીવફેર અર્થ ખાતે	૫,૪૫,૮૦૫-૦૦	
૨,૪૯,૩૯,૦૯૧-૩૦			સરવાળો ૨		૨,૪૩,૩૮,૭૨૩-૭૨
૦-૦૦	૩.		શ્રી ડાયરેક્ટર ફી અને એલાઉન્સ		૦-૦૦
	૪.		ભાડું, કર, વીમા પ્રીમીયમ, વિજળી		
૪,૫૭,૨૭૩-૨૬		i.	શ્રી વિજળી અર્થ	૪,૭૭,૫૫૮-૩૦	
૧૬,૯૮,૬૬૩-૦૦		ii.	શ્રી ડીપોઝીટ ઇન્સ્યુરન્સ પ્રીમીયમ અર્થ	૧૭,૯૪,૬૫૦-૦૦	
૫૩,૫૧૭-૦૦		iii.	શ્રી ઇન્સ્યુરન્સ પ્રીમીયમ અર્થ	૫૮,૮૨૯-૦૦	
૩,૭૬,૯૧૮-૦૦		iv.	શ્રી જી.એસ.ટી. અર્થ	૪,૧૫,૦૪૦-૦૦	
૧,૬૧,૯૩૬-૦૦		v.	શ્રી હાઉસ ટેક્ષ અર્થ	૧,૭૫,૫૪૭-૦૦	
૨૭,૪૮,૩૦૭-૨૬			સરવાળો ૪		૨૯,૨૧,૬૨૪-૩૦
૩૯,૭૫૦-૦૦	૫.		શ્રી લીગલ ફી અર્થ		૨૮,૭૧૫-૦૦
૯૪,૪૫૨-૯૪	૬.		શ્રી પોસ્ટેજ ટેલીગ્રામ અર્થ		૭૭,૭૬૫-૧૮
૨,૨૬,૦૦૦-૦૦	૭.		શ્રી ઓડીટ ફી અર્થ		૧,૯૭,૦૦૦-૦૦
૫,૨૬,૯૧૯-૮૪	૮.		શ્રી ઘસારા અર્થ		૩,૮૩,૯૧૩-૦૦
૨,૬૮,૪૯૮-૦૨	૯.		શ્રી સ્ટેશનરી પ્રિન્ટીંગ અને જાહેરાત અર્થ		૩,૨૩,૦૧૫-૨૬
૦-૦૦	૧૦.		નોન બેંકીંગ અસ્કયામતોના વેચાણમાં થયેલ નુકશાન		૦-૦૦
	૧૧.		શ્રી અન્ય અર્થ		
૧,૩૦,૬૨૧-૦૦		i.	શ્રી ભાડા ભથ્થા અર્થ	૮૯,૨૨૭-૦૦	
૪૮,૮૮૦-૦૦		ii.	શ્રી ફેડરેશન લવાજમ અર્થ	૪૮,૦૬૯-૦૦	
૬,૭૦,૯૮૭-૧૧		iii.	શ્રી પરચુરણ અર્થ ખાતે	૮,૦૭,૪૮૨-૯૨	
૫૩,૪૫૮-૦૦		iv.	શ્રી સાધારણ સભા અર્થ ખાતે	૬૯,૪૭૧-૦૦	
૫,૧૪,૨૦૮-૧૮		v.	શ્રી કોમ્પ્યુટર રીપેરીંગ અર્થ ખાતે	૬,૫૩,૧૭૦-૭૧	
૧,૫૫,૨૨૧-૦૦		vi.	શ્રી વાર્ષિક મેઈન્ટેનન્સ (A.M.C.) અર્થ ખાતે	૯૬,૧૯૨-૪૪	
૬૫,૫૦૫-૦૦		vii.	શ્રી રીકવરી અર્થ ખાતે	૫,૧૩૪-૦૦	
૯,૬૭૦-૯૪		viii.	શ્રી કલીયરીંગ અને ચેક પ્રોસેસિંગ ચાર્જ	૮,૦૯૪-૪૩	
૯૦,૦૦૦-૦૦		xi.	શ્રી કોર બેંકીંગ લીઝ લાઈન અર્થ ખાતે	૧,૦૬,૫૦૦-૦૦	
૨,૦૦,૦૦૦-૦૦		x.	શ્રી સ્ટાફ મરણોત્તર સહાય અર્થ ખાતે	૦-૦૦	
૧૬,૫૧૦-૦૦		xi.	શ્રી લોસ ઓન સેલ ઓફ એસેટ્સ	૬,૯૧,૬૮૭-૦૦	
૯,૩૮,૬૭૩-૦૦		xii.	શ્રી એપ્રેન્ટીસ સ્ટાઈપેન્ડ અર્થ ખાતે	૧૦,૮૩,૧૨૫-૦૦	
૧૮,૭૩૦-૦૦		xiii.	શ્રી કમીશન ઓન સ્ટેમ્પ ડેન્કીંગ અર્થ ખાતે	૪,૦૯૫-૦૦	
૦૦-૦૦		xiv.	શ્રી લોકર સપ્લીમેન્ટ્રી એગ્રીમેન્ટ સ્ટેમ્પ અર્થ ખાતે	૧,૭૧,૯૦૦-૦૦	
૦૦-૦૦		xv.	શ્રી સીક્યુટીરી સ્ટાફ અર્થ ખાતે	૧,૨૧,૭૭૬-૦૦	
૦૦-૦૦		xvi.	શ્રી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશન અર્થ ખાતે	૨૦,૩૦૫-૦૮	
૨૯,૧૨,૪૬૪-૨૩			સરવાળો ૧૧		૩૯,૭૬,૨૨૯-૫૮



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું					
૩૧-૦૩-૨૦૨૪	ક્રમાંક	પેટા ક્રમાંક	આવક		૩૧-૦૩-૨૦૨૫
૧૩,૯૫,૬૩,૭૪૯-૦૦ ૪,૮૦,૭૭,૦૬૮-૮૯ ૨,૫૪,૧૮૭.૦૦ ૧૮,૭૮,૬૫,૦૦૪-૮૯	૧.	અ. બ. ક.	શ્રી વ્યાજ આવક ધીરાણો તથા રોકાણોનું વ્યાજ તથા ડીવીડન્ડ ગવર્નમેન્ટ સિક્યુરીટીનું વ્યાજ દંડનીય વ્યાજ સરવાળો ૧	૧૯,૮૧,૮૮,૬૩૦-૫૪ ૪,૬૯,૧૭,૫૦૦-૦૦ ૨,૧૩,૯૨૮.૦૦	૨૪,૫૩,૨૦,૦૫૮-૫૪
૪૩,૩૧૦-૭૬	૨.		શ્રી કમીશન આવક		૩૫,૦૯૬-૬૧
૦-૦૦	૩.		સબસીડી અને ડોનેશન		૦-૦૦
૦-૦૦	૪.		ઈન્કમ ફ્રોમ નોન બેન્કિંગ એસેટ્સ અને પ્રોફીટ ફ્રોમ સેલ ઓફ ડીલીંગ વીથ સચ એસેટ્સ		૦-૦૦
૯,૧૯,૩૬૦-૦૦ ૧૭,૮૫,૮૯૪-૫૯ ૮,૬૮,૦૦૦-૦૦ ૫,૯૪,૨૪૫-૦૦ ૧,૧૭,૪૧,૦૨૫.૦૦ ૧,૫૯,૦૮,૫૨૪-૫૯ ૦-૦૦	૫.	અ. બ. ક. ડ. ઈ.	અન્ય આવક શ્રી લોકર ભાડા આવક શ્રી પરચુરણ આવક શ્રી પ્રોફીટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ શ્રી વધારાનું ટેક્સ પ્રોવિઝન પરત ખાતે શ્રી એક્સેસ ઇન્વેસ્ટમેન્ટ ધસારા પ્રોવિઝન રીઈન બેક ખાતે સરવાળો ૫	૯,૩૬,૭૪૦-૦૦ ૧૯,૮૧,૮૭૧-૮૭ ૦-૦૦ ૫,૦૬,૬૦૦-૦૦ ૮૬,૮૫,૩૨૦.૦૦	૧,૨૧,૧૦,૫૩૧-૮૭
	૬.		લોસ (if any)		૦-૦૦
૨૦,૩૮,૪૬,૮૪૦-૨૪			કુલ સરવાળો...		૨૫,૭૪,૬૫,૬૮૭-૦૨

વામનભાઈ જે. મહેતા
જનરલ મેનેજર

દીપ્તિભાઈ એન. વાળા
મેનેજર

જયેશભાઈ એન. ઘોળકીયા
ચેરમેન

: ડિરેક્ટરશ્રીઓ :

અશ્વિનભાઈ સી. ગોરડીયા
રાજેન્દ્રકુમાર ડી. જાની
ધીરેન્દ્રકુમાર કે. મહેતા
મહેન્દ્રભાઈ એન. મણીચાર

શરદભાઈ એન. ગોરડીયા
ધનસુખભાઈ ડી. રાઠોડ
યોગેશભાઈ આર. મહેતા
પ્રકાશભાઈ એમ. મહેતા

પ્રકાશભાઈ એન. સલોત
પંકજભાઈ વી. જાની
અશોકભાઈ એસ. મુની

ભાવનાબેન પી. કળથીયા
મીનાક્ષીબેન એમ. દવે
શૌલેષભાઈ જે. દવે
(કો-ઓપ્. પ્રો. ડિરેક્ટર)



તા. ૩૧-૦૩-૨૦૨૫નાં રોજ થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

૩૧-૦૩-૨૦૨૪	ક્રમાંક	પેટા ક્રમાંક	અર્થ		૩૧-૦૩-૨૦૨૫
૧,૦૫,૦૦,૦૦૦-૦૦ ૪૦,૦૦,૦૦૦-૦૦ ૧,૦૦,૦૦,૦૦૦-૦૦ ૮,૧૬,૧૭૦-૦૦ ૦-૦૦ ૦-૦૦	૧૨.	i. ii. iii. iv. v. vi.	શ્રી પ્રોવીઝન્સ શ્રી ઇન્કમેટેક્સ જવાબદારી પ્રોવિઝન શ્રી કન્ટીજન્સી લાયાબીલીટી પ્રોવિઝન શ્રી એન.પી.એ. પ્રોવિઝન શ્રી ઇન્કમેટેક્સ રીફંડ રીસીવેબલ પ્રોવિઝન શ્રી સ્ટાન્ડર્ડ એસેટ્સ પ્રોવિઝન શ્રી B.D.D.R. પ્રોવિઝન	૧,૧૦,૦૦,૦૦૦-૦૦ ૪૦,૦૦,૦૦૦-૦૦ ૦-૦૦ ૦-૦૦ ૮,૦૦,૦૦૦-૦૦ ૧,૨૦,૦૦,૦૦૦-૦૦	૨,૭૮,૦૦,૦૦૦-૦૦ ૧,૬૭,૩૮,૮૮૫-૧૦
૨,૫૩,૧૬,૧૭૦-૦૦ ૧,૮૩,૯૩,૬૫૯-૪૧	૧૩.		સરવાળો ૧૨ શ્રી ચાલુ સાલનો નફો સરવૈયામાં લઈ જતાં		
૨૦,૩૮,૪૬,૮૪૦-૨૪			કુલ સરવાળો...		૨૫,૭૪,૬૫,૬૮૭-૦૨

આજ તારીખનાં અમારા જુદા રીપોર્ટ મુજબ

ફોર, DSKHTP & Associates LLP

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

સીએ તેજસ રૂપાણી

FRN - 119285W/W100631 M. No. 137309

તા. ૦૫-૦૬-૨૦૨૫

UDIN : 25137309BMIABW3322

અલ્પેશભાઈ કે. શેઠ

બ્રાંચ મેનેજર

પ્રકાશભાઈ બી. મકવાણી

બ્રાંચ મેનેજર

SIHOR NAGARIK SAHAKARI BANK LIMITED

NOTES ON PREPARATION OF FINANCIAL STATEMENTS FOR THE YEAR ENDED ON MARCH 31, 2025

I. Overview

1. Background:

Sihor Nagarik Sahakari Bank Limited was incorporated in 1966 and at present having 3 Branches. The Bank provides various products that cater to the needs of its customers.

2. Basis of Preparation:

The accompanying Financial Statements have been prepared and presented under the historical cost convention on accrual basis of accounting, unless otherwise stated, on a going concern basis and comply with the Generally Accepted Accounting Principles (GAAP), statutory requirements prescribed under the Banking Regulation Act, 1949, and the Gujarat Co-operative Act, 1961, circulars and guidelines issued by the Reserve bank of India (RBI) from time to time, Accounting Standards (AS) issued by the Institute of Chartered Accountants of India (ICAI) and the current practices prevailing within the Banking industry in India.

3. Use of Estimates (AS-5):

The preparation of the financial Statements, in conformity with Generally Accepted Accounting Principles (GAAP) in India, Requires management to make estimates and assumptions considered in the reported amounts of assets and liabilities, revenues and expenses and disclosure of contingent liabilities as of the date of financial statements. Actual results could differ from those estimates. Management believes that the estimates used in the preparation of the financial statement are prudent and reasonable. Any revision in the accounting estimates is recognized prospectively in the current and future periods.

II. Significant Accounting Policies:



1. Accounting Convention: (AS-1)

The financial statements are drawn up in accordance with the historical cost convention and on “Going Concern” basis.

2. Investments (AS-13)

2.1 Classification of Investments

For the purpose of Disclosure in Balance Sheet the investments have been classified in the following categories as per RBI Guidelines.

- (1) Government Securities (Central & State)
- (2) Other approved securities
- (3) Share of other Co-Operative Institutions
- (4) Bonds of PSUs
- (5) Other Investments.

2.2 Categorization of Investments

In accordance with the RBI guidelines, the entire investment portfolio of the Bank is classified into three categories viz.:

- (a) Held to Maturity (HTM) : Securities acquired by the Bank with the intention to hold till maturity.
- (b) Held for Trading (HFT) : Securities acquired by the Bank with the intention to trade.
- (c) Available for Sale (AFS) : Securities which do not fall within the above two categories are classified as “available for sale”

2.3 Valuation of Investments

(i) Held to maturity :- Investment under HTM category are Carried at their acquisition cost or at amortized Cost. Any Premium on acquisition is amortized over the balance period to maturity, with a debit to profit & Loss Account. The book value of security is reduced to the extent of amount amortized during the relevant accounting period.

(ii) Held for Trading :- Investments under HFT category is Marked to Market at the year end. The net resultant depreciation in each classification is recognized in the Profit and Loss Account. Net Appreciation, if any, is ignored.

(iii) Available for Sale :- Investments under AFS category is Marked to Market at the year end. The net resultant depreciation in each classification is recognized in the Profit and Loss Account. Net Appreciation, if any, is ignored.

(vi) Shares of Co-operative Institution and Financial Corporations are valued at cost unless there is a diminution in the value thereof in which case the diminution is fully provided for.

(v) Market Value of the Government Securities under Available for Sale is determined in terms of Yield to Maturity (YTM) method indicated by Financial Benchmark India Pvt. Ltd. (FBILL).

(vi) Broken period interest on debt instruments is treated as revenue item. Brokerage, Commission etc paid if any in respect of investments purchased are recognized as expenditure.

(vii) Transfers from/to Category are done once in a year preferably at the beginning of the year as per the RBI guidelines.

(viii) Units of Debt/Money Market Liquid Fund are valued at the lower of cost or net asset value provided by respective Debt/Money Market Liquid Fund. In case of funds with lock in periods or where re-purchase price/market quote is not available, units are to be valued at Net Asset Value (NAV). If NAV is not available, then this would be valued at cost till the end of the lock in period.

3. Advances

(i) All advances are classified as Standard, Sub-standard, Doubtful and Loss Assets in accordance with guidelines issued by RBI, unless otherwise stated. Provisions are made in accordance with the prudential norms prescribed by Reserve Bank of India from time to time.

(ii) The overdue interest in respect of non-performing advances is provided separately under Overdue Interest Reserve as per directives issued by Reserve Bank of India.

(iii) The recovery in NPA account is first appropriated towards principle only and after recovery of principle in full the further recovery if any will be appropriated towards interest income and charges in terms of point no 6 of Annexure-V of master circular of RBI No. UBC (PCB) MC No. 3 dated 01.07.2010 on IRAC norms.



4. Fixed Assets (AS-10) & Depreciation (AS-6)

- Premises and other fixed Assets have been accounted for at historical cost less Depreciation except land.
- They are depreciated on 31/03 once in a year.
- There is no revaluation of any assets during the year.
- No depreciation is provided on fixed assets sold or discarded during the year. Profit/Loss on sale of fixed assets is transferred to profit and loss account.
- Rates used for providing depreciation are as under:

Fixed Asset	Depreciation Method Used	Rate of Depreciation
Land	-	0.00%
Building	WDV	10.00%
Computer & Peripherals	SLM	33.33%
Other Equipment	WDV	15.00%
Electric Equipment	WDV	15.00%
Furniture & Fixtures	WDV	10.00%

5. Revenue Recognition (AS-9)

(i) Income:

Interest and other income are recognized on accrual basis except the following, which are recognized on realization basis as per RBI Guidelines.

- Interest and other income on Non Performing Advances as per RBI Norms
- Locker Rent
- Dividend on shares of Co-operative Institutions
- Dividend on units of Debt/Money Market Liquid Fund
- Commission Income
- Profit or Loss on sale of Investments

(ii) Expenditure :

Revenue expenditure is accounted for on accrual basis except the following, which are recognized on payment basis.

- Postage and Local Authorities Dues etc
- Insurance Premium and Maintenance Contract expenses
- Leave Encashment Payment
- Law Charges
- Ex-gratia to Staff

6. Employee Benefits (AS-15)

(a) Provident Fund:

Eligible employees receive benefits from Provident Fund, which is defined under contribution plan. The Contribution made by the Bank is charged to Profit & Loss Account. The Bank has no further obligation under the Provident Fund plan beyond its monthly contribution. The provident fund has to be deposited every month in the District office of the Employees Provident Fund Organization the monthly returns are being sent before due date.

(b) Gratuity and Leave Salary

The bank has taken group gratuity insurance with the Life Insurance Corporation of India (LIC) for payment of retirement and gratuity under the group gratuity scheme of LIC. The annual contribution to gratuity is paid on yearly basis as per actuarial valuation of accrued liability in this respect LIC and recognized as expenses in the profit and loss account. For Leave Encashment liabilities Bank has made adequate provision and has got issued a fix deposit in B.D.C Bank Ltd. As on 31/03/2025 there is a fixed deposit of Rs. 69,25,000/-.

Bank has paid to Life Insurance Corporation of India towards Contribution (premium) during the year as under:

Group Gratuity (Cash Accumulation) Policy Rs. 12,49,232/- and
Fund Value as per statement of LIC as on 31.03.2025 is Rs. 2,12,30,917/-



7. Segment Reporting (AS-17):

For the purpose of Segment Reporting, the reportable segments are: Business Segment and Geographical Segment.

A business segment is a distinguishable component of an enterprise that is engaged in providing an individual product or service or a group of related products or services and that is subject to risks and returns that are different from those of other business segments. The Bank operates only in core banking services segment hence the reporting consists only of retail banking segment.

A geographical segment is a distinguishable component of an enterprise that is engaged in providing products or services within a particular economic environment and that is subject to risks and returns that are different from those of components operating in other economic environments. The Bank operates only in India and hence the reporting consists only of domestic segment.

8. Related Party Disclosures (AS 18):

During the year under audit, the advances allowed to members of BOD or their relatives or to associate concerns are as per RBI guidelines. All such advances are recoverable.

The key management personnel (KMP) consisted of the Chief Executive Officer of the Bank. Since the Chief Executive Officer of the Bank is a Single Party under the Category Key Management Personnel, no further disclosure required.

9. Leases (AS-19):

All premises of the bank are owned premises, therefore, no disclosure of lease is required.

10. Consolidated Financial Statements (AS-21):

Figures of head office and all Three branches are consolidated in the financial statements.

11. Taxation (AS-22):

Current year Tax is determined as the amount of tax payable in respect of taxable income for the year on estimated basis and advance Tax payment made is shown in the balance sheet under the head other assets. The bank has not provided for deferred tax asset / liability.

12. Impairment of Assets (AS-28):

The bank assesses at each balance sheet date whether there is any indication that an asset may be impaired. Impairment loss, if any, is provided in the statement of profit and loss to the extent the carrying amount of assets exceeds their estimated recoverable amount.

13. Contingent Assets and Contingent Liabilities (AS-29):

(i)Contingent Assets are neither recognized nor disclosed in the financial statement.

(ii)Contingent Liabilities in respect of Bank Guarantees, RBI DEAF Scheme and claims not acknowledged as debts are disclosed under footnotes in the balance sheet.

14. Prior Period Items (AS-5):

There are no items of material significance in the prior period amount requiring disclosure.

15. Event occurring after Balance Sheet Date (AS-4):

Material adjusting events (that provides evidence of condition that existed at the balance sheet date) occurring after the balance sheet date are recognized in the financial statement. Non-adjusting events (that are indicative of conditions that arose subsequent to the balance sheet date occurring after balance sheet date) that represent material change and commitment affecting the financial Position are disclosed in the report of the Board of Directors, if any.

Cash and Cash Equivalent

Cash and Cash Equivalent include cash on hand and in ATM, Balances with Reserve Bank of India, State Bank of India, State Co.op. Bank, Dist. Co.op. Bank.

Previous year's figures are regrouped or rearranged, wherever necessary, to conform to the layout of the accounts of the current year.

For, DSKHTP & Associates LLP

Chartered Accountants

(FRN : 119285W/W100631)

CA TEJAS RUPANI

(Partner)

M. No. . 137309

Place : Rajkot

Date : 05-06-2025

UDIN : 25137309BMIABW3322



SIHOR NAGARIK SAHAKARI BANK LIMITED

Notes to Accounts forming part of Financial Statements

Disclosures in terms of RBI Cir DOR.ACC.REC.No 46/21.04.018/2021-22 dated 30 August 2021

(Amounts in ₹ crore)

Sr. No.	Sub Sr.No.	Particulars of Disclosure as per RBI Circular	31.03.2025 Current Year	31.03.2024 Previous Year
1	Regulatory Capital			
	a) Composition of Regulatory Capital			
	i)	Common Equity Tier 1 capital (CET 1)* / Paid up share capital and reserves@ (net of deductions, if any)	16.04	12.03
	ii)	Additional Tier 1 capital*/ Other Tier 1 capital	0.00	0.00
	iii)	Tier 1 capital (i + ii)	16.04	12.03
	iv)	Tier 2 capital	4.83	1.22
	v)	Total capital (Tier 1+Tier 2)	20.87	13.25
	vi)	Total Risk Weighted Assets (RWAs)	79.93	69.69
	vii)	CET 1 Ratio (CET 1 as a percentage of RWAs)* / Paid-up share capital and reserves as percentage of RWAs	20.07%	17.26%
	viii)	Tier 1 Ratio (Tier 1 capital as a percentage of RWAs)	20.07%	17.26%
	ix)	Tier 2 Ratio (Tier 2 capital as a percentage of RWAs)	6.04%	1.75%
	x)	Capital to Risk Weighted Assets Ratio (CRAR) (Total Capital as a percentage of RWAs)	26.11%	19.01%
	xi)	Leverage Ratio	NA	NA
	xii)	Percentage of the shareholding of	NA	NA
		a) Government of India	NA	NA
		b) State Government (specify name)	NA	NA
		c) Sponsor Bank	NA	NA
	xiii)	Amount of paid-up equity capital raised during the year	0.21	0.28
	xiv)	Amount of non-equity Tier 1 capital raised during the year		
	xv)	Amount of Tier 2 capital raised during the year		
	b) Drawdown from Reserves		NIL	NIL
2	Asset Liability Management			
	a) Maturity pattern of certain items of assets and liabilities		Annex - 2a	Annex - 2a
	b) Liquidity Coverage Ratio		NA	NA
	c) Net Stable Funding Ratio		NA	NA
3	Investments			
	a) Composition of Investment Portfolio		Annex - 3a	Annex - 3a
	b) Movement of Provisions for Depreciation and Investment Fluctuation Reserve			
	i) Movement of provisions held towards depreciation on investments			
	a)	Opening balance	0.90	2.07
	b)	Add: Provisions made during the year	0.00	0.00
	c)	Less: Write off / write back of excess provisions during the year	0.87	1.17
	d)	Closing balance	0.03	0.90
	ii) Movement of provisions held towards Fluctuation on investments			
	a)	Opening balance	3.43	2.78
	b)	Add: Amount transferred during the year	0.40	0.65
	c)	Less: Drawdown	0.00	0.00
	d)	Closing balance	3.83	3.43



(Amounts in ₹ crore)

Sr. No.	Sub Sr.No.	Particulars of Disclosure as per RBI Circular	31.03.2025 Current Year	31.03.2024 Previous Year
	iii)	Closing balance in IFR as a percentage of closing balance of investments in AFS and HFT/Current category	6.22%	5.57%
	c)	Sale and Transfers to/from HTM Category		
		Sale to/from HTM Category	0.00	4.50
		Transfers to/from HTM Category	0.00	0.00
	d)	Non SLR Investment Portfolio		
	i)	Non Performing Non-SLR Investments		
	a)	Opening Balance	0.00	0.00
	b)	Addition during the year since 1 st April	0.00	0.00
	c)	Reduction during the above period	0.00	0.00
	d)	Closing Balance	0.00	0.00
	e)	Total Provision held	0.00	0.00
	ii)	Issuer composition of Non-SLR Investments	Annex-3d(ii)	Annex-3d(ii)
	e)	Repor transactions (in Face Value Terms)	NA	NA
4		Asset Quality		
	a)	Classification of Advances and Provisions Held	Annex-4a	Annex-4a
	b)	Sector-wise Advances and Gross NPAs	Annex-4b	Annex-4b
	c)	Overseas assets, NPAs and revenue	NA	NA
	d)	Particulars of resolution plan and restructuring	NA	NA
	e)	Divergence in asset classification and provisioning	NA	NA
	f)	Disclosure of transfer of loan exposures	NA	NA
	g)	Fraud Accounts		
		Banks shall make disclose details on the number and amount of frauds as well as the provisioning thereon as per template given below.		
		Number of frauds reported	NA	NA
		Amount involved in fraud (₹ crore)	NA	NA
		Amount of provision made for such frauds (₹ crore)	NA	NA
		Amount of Unamortised provision debited from 'other reserves' as at the end of the year (₹ crore)	NA	NA
	h)	Disclosures under Resolution Framework for COVID-19- related Stress	NA	NA
5		Exposures		
	a)	Exposures to real estate sector		
		Category		
	i)	Direct exposure		
	a)	Residential Mortgages –		
		Lending fully secured by mortgages on residential property that is or will be occupied by the borrower or that is rented. Individual housing loans eligible for inclusion in priority sector advances shall be shown separately. Exposure would also include non-fund based (NFB) limits.	4.82	4.32
		-- Housing Loans under Priority Sector Lending	3.48	3.33



Sr. No.	Sub Sr.No.	Particulars of Disclosure as per RBI Circular	31.03.2025 Current Year	31.03.2024 Previous Year
	b)	Commercial Real Estate –		
		Lending secured by mortgages on commercial real estate (office buildings, retail space, multipurpose commercial premises, multifamily residential buildings, multi tenanted commercial premises, industrial or warehouse space, hotels, land acquisition, development and construction, etc.). Exposure would also include non-fund based (NFB) limits;	1.97	2.20
	c)	Investments in Mortgage-Backed Securities (MBS) and other securitized exposures –	NIL	NIL
	i.	Residential		
	ii.	Commercial Real Estate		
	ii)	Indirect Exposure		
		Fund based and non-fund-based exposures on National Housing Bank and Housing Finance Companies.	NA	NA
		Total Exposure to Real Estate Sector	6.79	6.52
	b)	Exposures to capital market	NA	NA
	c)	Risk category-wise country exposures	NA	NA
	d)	Unsecured advances		
		Total unsecured advances of the bank	1.56	1.52
		Out of the above, amount of advances for which intangible securities such as charge over the rights, licenses, authority, etc. have been taken	0.00	0.00
		Estimated value of such intangible securities	0.00	0.00
	e)	Factoring exposures	NA	NA
	f)	Intra-group exposures	NA	NA
	g)	Unhedged foreign currency exposures	NA	NA
6		Concentration of deposits, advances, exposures and NPAs		
	a)	Concentration of deposits		
		Total deposits of the twenty largest depositors	19.07	18.00
		Percentage of deposits of twenty largest depositors to total deposits of the bank	12.71%	12.99%
	b)	Concentration of advances*		
		Total advances to the twenty largest borrowers	14.71	12.68
		Percentage of advances to twenty largest borrowers to total advances of the bank	15.35%	15.07%
	c)	Concentration of exposures**		
		Total exposure to the twenty largest borrowers/customers	33.78	30.68
		Percentage of exposures to the twenty largest borrowers/ customers to the total	13.74%	13.78%
		**Exposures shall be computed as per applicable RBI regulation.		
	d)	Concentration of NPAs		
		Total Exposure to the top twenty NPA accounts	4.84	4.71
		Percentage of exposures to the twenty largest NPA exposure to total Gross NPAs.	64.13%	62.19%
7		Derivatives	NA	NA
8		Disclosures relating to securitisation	NA	NA



(Amounts in ₹ crore)				
Sr. No.	Sub Sr.No.	Particulars of Disclosure as per RBI Circular	31.03.2025 Current Year	31.03.2024 Previous Year
9		Off balance sheet SPVs sponsored (which are required to be consolidated as per accounting norms)	NA	NA
10		Transfers to Depositor Education and Awareness Fund (DEA Fund)		
	i)	Opening balance of amounts transferred to DEA Fund	0.58	0.58
	ii)	Add: Amounts transferred to DEA Fund during the year	0.04	0.01
	iii)	Less: Amounts reimbursed by DEA Fund towards claims	0.00	0.01
	iv)	Closing balance of amounts transferred to DEA Fund	0.62	0.58
11		Disclosure of complaints		
	a)	Summary information on complaints received by the bank from customers and from the Offices of		
		Complaints received by the bank from its customers		
	1	Number of complaints pending at beginning of the year	0	0
	2	Number of complaints received during the year	0	0
	3	Number of complaints disposed during the year	0	0
	3.1	Of which, number of complaints rejected by the bank	0	0
	4	Number of complaints pending at the end of the year	0	0
		Maintainable complaints received by the bank from Office of Ombudsman		
	5	Number of maintainable complaints received by the bank from Office of Ombudsman	0	0
	5.1	Of 5, number of complaints resolved in favour of the bank by Office of Ombudsman	0	0
	5.2	Of 5, number of complaints resolved through conciliation/mediation/advisories issued by Office of Ombudsman	0	0
	5.3	Of 5, number of complaints resolved after passing of Awards by Office of Ombudsman against the bank	0	0
	6	Number of Awards unimplemented within the stipulated time (other than those appealed)	0	0
		Note: Maintainable complaints refer to complaints on the grounds specifically mentioned in Integrated Ombudsman Scheme, 2021 (Previously Banking Ombudsman Scheme, 2006) and covered within the ambit of the Scheme.		
	b)	Top five grounds of complaints received by the bank from customers	Anex-11b	Anex-11b
12		Disclosure of penalties imposed by Reserve Bank of India	NA	NA
13		Disclosure on remuneration	NA	NA
14		Other Disclosures		
	a)	Business ratios		
	i)	Interest Income as a percentage to Working Funds	9.22%	8.60%
	ii)	Non-interest income as a percentage to Working Funds	0.67%	0.94%
	iii)	Cost of Deposits	6.81%	6.32%
	iv)	Net Interest Margin	3.86%	3.63%
	v)	Operating Profit as a percentage to Working Funds	2.63%	2.54%
	vi)	Return on Assets	1.07%	1.07%
	vii)	Business (deposits plus advances) per employee (in ₹ crore)	5.85	4.84
	viii)	Profit per employee (in ₹ crore)	0.05	0.04
		Revaluation of Fixed Assets	NA	NA
		Book Value	NA	NA
		Revalued	NA	NA
		Revaluation Reserve	NIL	NIL
		No of Branches	3	3
		No of Staff Members	42	46



(Amounts in ₹ crore)

Sr. No.	Sub Sr.No.	Particulars of Disclosure as per RBI Circular	31.03.2025	31.03.2024
			Current Year	Previous Year
b)		Bancassurance Business	NA	NA
c)		Marketing and Distribution	NA	NA
d)		Disclosures regarding Priority Sector Lending Certificates (PSLCs)	NA	NA
e)		Provisions and contingencies		
		Provision debited to Profit and Loss Account		
	i)	Provisions for NPI	0.00	0.00
	ii)	Provision towards NPA	1.20	1.00
	iii)	Provision made towards Income tax	1.10	1.05
	iv)	Other Provisions and Contingencies (with details)		
	(a)	Staff Leave Encashment Provision	0.00	0.00
	(b)	Contingent Liability Provision	0.40	0.40
	(c)	Investment Depreciation Provision	0.00	0.00
	(d)	Standard Assets Provision	0.08	0.00
f)		Implementation of IFRS on converged Indian Accounting Standards	NA	NA
g)		Payment of DICGC Insurance Premium		
	i)	Payment of DICGC Insurance Premium	0.18	0.17
	ii)	Arrears in payment of DICGC premium	0.00	0.00
h)		Disclosure of facilities granted to directors and their relatives	Annex-14h	Annex-14h
i)		Disclosure on amortisation of expenditure on account of enhancement in family pension of employees of banks	NA	NA

Annexure – 2a

Maturity pattern of certain items of assets and liabilities

As At 31-03-2025

(Amount in ₹ crore)

	day 1	2 to 7 days	8 to 14 days	15 to 30 days	31 to 2 months	Over 2 months & to 3 months	Over 3 months & up to 6 months	Over 6 months & up to 1 year	Over 1 year & up to 3 years	Over 3 years & up to 5 years	over 5 years	total
Deposits	15.79	3.38	4.52	5.08	9.99	7.94	19.39	44.42	34.64	3.00	1.87	150.02
Advances	4.23	0.27	0.30	0.69	1.88	1.52	4.71	16.57	1.85	1.38	62.41	95.81
Investments	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	9.66	2.76	54.88	67.30
Borrowings	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Foreign Currency assets	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA
Foreign Currency liabilities	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA

Annexure – 2a

Maturity pattern of certain items of assets and liabilities

As At 31-03-2024

(Amount in ₹ crore)

	day 1	2 to 7 days	8 to 14 days	15 to 30 days	31 to 2 months	Over 2 months & to 3 months	Over 3 months & up to 6 months	Over 6 months & up to 1 year	Over 1 year & up to 3 years	Over 3 years & up to 5 years	over 5 years	total
Deposits	17.18	3.07	4.22	3.57	8.04	7.52	17.36	40.08	33.31	2.04	2.20	138.59
Advances	4.38	0.25	0.28	0.58	1.49	1.15	3.91	13.92	1.67	2.60	53.90	84.13
Investments	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.47	11.46	55.37	67.30
Borrowings	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Foreign Currency assets	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA
Foreign Currency liabilities	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA



Annexure -3a

A) As at 31-03-2025

Composition of Investment Portfolio

(Amount in ₹ crore)

	Investment in India							Investment outside India
	Govt Securities	Other Approved Securities	Shares	Debentures and Bond	Subsidiaries and/or Joint ventures	Others	Total Investment in India	NIL
Held to Maturity								
Gross	5.57	0.00	0.09	0.00	0.00	0.00	5.66	
Less: Provision for non performing investment (NPI)	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Net	5.57	0.00	0.09	0.00	0.00	0.00	5.66	
Available for Sale								
Gross	61.64	0.00	0.00	0.00	0.00	0.00	61.64	
Less: Provision for depreciation and NPI	0.03	0.00	0.00	0.00	0.00	0.00	0.03	
Net	61.61	0.00	0.00	0.00	0.00	0.00	61.61	
Held for Trading								
Gross	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Less: Provision for depreciation and NPI	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Net	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Total Investment								
Gross	67.21	0.00	0.09	0.00	0.00	0.00	67.30	
Less: Provision for non performing investment (NPI)	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Less: Provision for depreciation and NPI	0.03	0.00	0.00	0.00	0.00	0.00	0.03	
Net	67.18	0.00	0.09	0.00	0.00	0.00	67.27	

Annexure – 14h

Disclosure of facilities granted to directors and their relatives

As at 31-03-2025

(Amounts in ₹ crore)

Name of Director	Name of Borrower	Relation with Borrower	Type of Exposure	Limit	O/s as on 31.03.2025
DHIRENDRABHAI K. MEHTA	Shreeji Traders	Self	FDOD	0.09	0.08
	Pro. DHIRENDRABHAI K. MEHTA				
DHIRENDRABHAI K. MEHTA	Shreeji Traders	Self	FDOD	0.01	0.01
	Pro. SARTHAK DHIRENDRABHAI MEHTA				



3. Investment

Annexure -3a

A) As at 31-03-2024

Composition of Investment Portfolio

(Amount in ₹ crore)

	Investment in India							Investment outside India
	Govt Securities	Other Approved Securities	Shares	Debentures and Bond	Subsidiaries and/or Joint ventures	Others	Total Investment in India	NIL
Held to Maturity								
Gross	5.57	0.00	0.09	0.00	0.00	0.00	5.66	
Less: Provision for non performing investment (NPI)	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Net	5.57	0.00	0.09	0.00	0.00	0.00	5.66	
Available for Sale								
Gross	61.64	0.00	0.00	0.00	0.00	0.00	61.64	
Less: Provision for depreciation and NPI	0.90	0.00	0.00	0.00	0.00	0.00	0.90	
Net	60.74	0.00	0.00	0.00	0.00	0.00	60.74	
Held for Trading								
Gross	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Less: Provision for depreciation and NPI	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Net	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Total Investment								
Gross	67.21	0.00	0.09	0.00	0.00	0.00	67.30	
Less: Provision for non performing investment (NPI)	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Less: Provision for depreciation and NPI	0.90	0.00	0.00	0.00	0.00	0.00	0.90	
Net	66.31	0.00	0.09	0.00	0.00	0.00	66.40	

Annexure – 14h

Disclosure of facilities granted to directors and their relatives

As at 31-03-2024

(Amounts in ₹ crore)

Name of Director	Name of Borrower	Relation with Borrower	Type of Exposure	Limit	O/s as on 31.03.2024
DHIRENDRABHAI K. MEHTA	Shreeji Traders	Self	FDOD	0.08	0.08
	Pro. DHIRENDRABHAI K. MEHTA				



Annexure – 3d (ii)
Issuer composition of Non-SLR investment

As at 31-03-2025

Sr. No	Issuer	Amount		Extent of Private		Extent of 'Below		Extent of 'Unrated'		Extent of 'Unlisted'	
		Current year	Previous Year	Current year	Previous Year	Current year	Previous Year	Current year	Previous Year	Current year	Previous Year
1	2										
a)	PSUs										
b)	FIs										
c)	Banks	0.09	0.09								
d)	Private Corporate										
e)	Subsidiaries/Joint ventures										
f)	Others										
g)	Provision held towards depreciation	0.00	0.00								
	Total	0.09	0.09								

Annexure – 3d (ii)
Issuer composition of Non-SLR investment

As at 31-03-2024

Sr. No	Issuer	Amount		Extent of Private		Extent of 'Below		Extent of 'Unrated'		Extent of 'Unlisted'	
		Current year	Previous Year	Current year	Previous Year	Current year	Previous Year	Current year	Previous Year	Current year	Previous Year
1	2										
a)	PSUs										
b)	FIs										
c)	Banks	0.09	0.09								
d)	Private Corporate										
e)	Subsidiaries/Joint ventures										
f)	Others										
g)	Provision held towards depreciation	0.00	0.00								
	Total	0.09	0.09								



Annexure -4a

Classification of Advances and Provision Held

As at 31-03-2025

(Amounts in ₹ crore)

Particulars	Total Standard Advances	Non-performing				Total
		Sub Standard	Doubtful	Loss	Total NPAs	
Gross standard advances and NPAs Opening Balance	76.55	1.49	4.51	1.58	7.58	84.13
Add: Additions during the year	--	--	--	--	3.48	
Less: Reduction during the year*	--	--	--	--	3.51	
Closing balance	88.26	2.71	3.32	1.52	7.55	95.81
Reductions in gross NPAs due to:	--	--	--	--		
i) Upgradation	--	--	--	--		
ii) Recoveries (Excluding recoveries from upgraded accounts)	--	--	--	--		
iii) Technical/Prudential Write-off	--	--	--	--		
iv) Write-offs other than those under (iii) above	--	--	--	--		
Provisions (excluding Floating Provisions)						
Opening balance of provision held	0.32				11.03	11.35
Add: Fresh provisions made during the year	0.08	--	--	--	1.47	1.55
Less: Excess provision reversed/write-off loan	--	--	--	--	3.35	3.35
Net NPAs	--	--	--	--	0.00	0.00
Closing balance of provision helds	0.40				9.15	9.55
Net NPAs						
Opening Balance	--				0.00	0.00
Add: Fresh additions during the year	--	--	--	--	0.00	--
Less: Reduction during the year	--	--	--	--	0.00	--
Closing Balance	--	0	0	0	0.00	0.00

Ratios

Ratios	Current Year	Previous Year
Gross NPA to Gross Advances	7.88%	9.01%
Net NPA to Net Advances	0.00%	0.00%
Provision coverage ratio	121.27%	145.48%



Annexure -4a
Classification of Advances and Provision Held

As at 31-03-2024

(Amounts in ₹ crore)

Particulars	Total Standard Advances	Non-performing				Total
		Sub Standard	Doubtful	Loss	Total NPAs	
Gross standard advances and NPAs Opening Balance	61.81	3.54	6.00	1.85	11.39	73.20
Add: Additions during the year	--	--	--	--	3.00	
Less: Reduction during the year*	--	--	--	--	6.81	
Closing balance	76.55	1.49	4.51	1.58	7.58	84.13
Reductions in gross NPAs due to:	--	--	--	--		
i) Upgradation	--	--	--	--		
ii) Recoveries (Excluding recoveries from upgraded accounts)	--	--	--	--		
iii) Technical/Prudential Write-off	--	--	--	--		
iv) Write-offs other than those under (iii) above	--	--	--	--		
Provisions (excluding Floating Provisions)						
Opening balance of provision held	0.32				9.77	10.09
Add: Fresh provisions made during the year	--	--	--	--	1.26	1.26
Less: Excess provision reversed/write-off loan	--	--	--	--	0.00	0.00
Net NPAs	--	--	--	--	0.00	0.00
Closing balance of provision helds	0.32				11.03	11.35
Net NPAs					0.00	0.00
Opening Balance	--				0.00	1.61
Add: Fresh additions during the year	--	--	--	--	0.00	--
Less: Reduction during the year	--	--	--	--	0.00	--
Closing Balance	--	0	0	0	0.00	0.00

Ratios

Ratios	Current Year	Previous Year
Gross NPA to Gross Advances	9.01%	15.56%
Net NPA to Net Advances	0.00%	2.54%
Provision coverage ratio	145.48%	85.84%



Annexure – 4b Sector-wise Advances and Gross NPAs

As At 31-03-2025

(Amounts in ₹ crore)

Sr. No.	Sector*	Current Year			Previous Year		
		Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector	Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector
i)	Priority Sector						
a)	Agriculture and allied activities						
b)	Retail Traders	19.06	1.50	19.88%	15.53	2.76	36.44%
c)	Small Business	3.97	0.41	5.43%	1.89	0.34	4.41%
d)	Small scale Industries	1.49	0.59	7.76%	0.40	0.36	4.79%
e)	Construction and repairs to build. (Housing loan)	8.62	0.47	6.19%	4.61	0.73	9.68%
f)	Small Road Transport Operators	0.76	0.02	0.23%	1.12	0.02	0.23%
g)	Professional and Self Employed	54.58	2.92	38.74%	55.43	2.38	31.39%
b)	Advances to industries sector eligible as priority sector lending						
c)	Services & d) Personal Loans						
	Subtotal (i)	88.48	5.91	78.23%	78.98	6.59	86.94%
ii)	Non-priority Sector						
a)	Agriculture and allied activities						
b)	Industry						
c)	Services & d) Personal Loans						
d)	Other	7.33	1.64	21.77%	5.15	0.99	13.06%
	Sub-total (ii)	7.33	1.64	21.77%	5.15	0.99	13.06%
	Total (i + ii)	95.81	7.55	100.00%	84.13	7.58	100.00%

Annexure – 11b

a) Top five grounds of complaints received by the bank from customers

As At 31-03-2025

Grounds of complaints, (i.e. complaints relating to)	Number of complaints pending at the beginning of the year	Number of complaints received during the year	% increase/decrease in the number of complaints received over the previous year	Number of complaints pending at the end of the year	Of 5, number of complaints pending beyond 30 days 1
Current Year					
Ground 1	NIL	NIL	0.00%	NIL	NIL
Ground 2	NIL	NIL	0.00%	NIL	NIL
Ground 3	NIL	NIL	0.00%	NIL	NIL
Ground 4	NIL	NIL	0.00%	NIL	NIL
Ground 5	NIL	NIL	0.00%	NIL	NIL
Others	NIL	NIL	0.00%	NIL	NIL
Previous Year					
Ground 1	NIL	NIL	0.00%	NIL	NIL
Ground	NIL	NIL	0.00%	NIL	NIL
Ground	NIL	NIL	0.00%	NIL	NIL
Ground	NIL	NIL	0.00%	NIL	NIL
Ground	NIL	NIL	0.00%	NIL	NIL
Others	NIL	NIL	0.00%	NIL	NIL



થાપણો ઉપરના વ્યાજના દર ૦૧-૦૭-૨૦૨૫ થી અમલી

વિગત	સામાન્ય થાપણો	સીનીયર સીટીઝન્સ થાપણો
૩૦ દિવસથી ૪૫ દિવસ સુધી	૪.૫૦ %	૪.૫૦ %
૪૬ દિવસથી ૯૦ દિવસ સુધી	૫.૦૦ %	૫.૦૦ %
૯૧ દિવસથી ૧૮૦ દિવસ સુધી	૫.૫૦ %	૫.૫૦ %
૧૮૧ દિવસથી ૧ વર્ષની અંદર	૬.૦૦ %	૬.૦૦ %
૧ વર્ષ અને તે ઉપરાંત	૭.૨૫ %	૭.૭૫ %

રીકરીંગ ડીપોઝીટ યોજના

માસિક રકમ ₹	૧૨ માસ પુરા થતાં ચુકવવાની કુલ રકમ	૨૪ માસ પુરા થતાં ચુકવવાની કુલ રકમ	૩૬ માસ પુરા થતાં ચુકવવાની કુલ રકમ
૧૦૦/-	૧૨૪૮	૨૫૮૮	૪૦૨૮
૨૦૦/-	૨૪૯૬	૫૧૭૭	૮૦૫૮
૫૦૦/-	૬૨૩૮	૧૨૮૪૪	૨૦૧૪૭
૧૦૦૦/-	૧૨૪૭૮	૨૫૮૮૭	૪૦૨૮૫

નોંધ : સીનીયર સીટીઝન્સને (૬૦ વર્ષ પૂરા) ૧ વર્ષ કે તેથી વધુ મુદત માટેની બાંધી મુદત થાપણો તેમજ કુબેર ડીપોઝીટ પર ૦.૫૦% (અર્ધો ટકો) વધારે વ્યાજ આપવામાં આવે છે. આ માટે જરૂરી આધાર રજૂ કરવા જરૂરી છે.

- આપના નાણાંનું યોગ્ય વળતર આપતી એક માત્ર બેન્ક એટલે આપણી સિહોર નાગરિક સહકારી બેન્ક લિ.
- આપની ₹ ૫,૦૦,૦૦૦/- સુધીની થાપણ વિમાથી સુરક્ષિત છે.
- રીકરીંગ યોજનામાં પ્રતિ માસ હપ્તાની રકમ ભર્યા પછી છેલ્લે હપ્તો ભરાયા બાદ ૩૦ દિવસે સંચયિત થયેલ આપની વ્યાજ સાથેની રકમ પરત ચુકવવાને પાત્ર છે.

સિહોર હેડ ઓફિસ

શ્રી ભોગીલાલ લાલાણી માર્ગ, સિહોર - ૩૬૪૨૪૦ (જી. ભાવનગર)

ફોન & ફેક્સ : (૦૨૮૪૬) ૨૨૨૦૭૪, ૨૨૨૦૭૫

E-mail : sihor@snsb.co.in, sihorho@snsb.co.in

દાણાપીઠ

મહેંદી ચોક, દાણાપીઠ, ભાવનગર - ૩૬૪૦૦૧.
ફોન - ફેક્સ : (૦૨૭૮) ૨૫૧૪૧૫૧, ૨૫૨૦૮૨૮
E-mail : danapith@snsb.co.in

શાખાઓ

શાસ્ત્રીનગર

શ્રીજીકૃપા કોમ્પ્લેક્સ, વિક્રલવાડી, શાસ્ત્રીનગર,
ભાવનગર - ૩૬૪૦૦૩. ફોન : ૨૫૧૩૮૪૮, ૨૪૩૨૮૨૨
E-mail : shastrinagar@snsb.co.in



R.B.I. Licence No. ACD GJ-2-P 8-12-1966
રજીસ્ટ્રેશન નં. સા-૪૦૮, તા. ૫-૮-૧૯૬૬

કામકાજની શરૂઆત : સિહોર તા. ૨૧-૧-૧૯૬૭
ભાવનગર દાણાપીઠ શાખા - તા. ૩૧-૧-૧૯૮૫
ભાવનગર શાસ્ત્રીનગર શાખા - તા. ૨૫-૧૦-૧૯૯૭

બોર્ડ ઓફ ડીરેક્ટર્સ સને ૨૦૨૪-૨૦૨૫

અ. નં.	વિગત	હોદ્દો	ટેલિફોન નંબર	
			ઓફિસ	ઘર
૧	શ્રી જયેશભાઈ એન. ઘોળકીયા	ચેરમેન	મો. ૯૨૨૭૫૦૬૪૮૯, ૯૮૨૫૨૦૬૪૮૯, ૨૨૨૦૩૭	૨૨૨૦૯૯
૨	શ્રી અશ્વિનભાઈ સી. ગોરડીયા	વાઈસ ચેરમેન	મો. ૯૪૨૭૯૧૨૫૬૩, ૨૨૨૧૪૨, ૨૨૫૧૪૨	૨૩૧૧૧૦
૩	શ્રી રાજેન્દ્રકુમાર ડી. જાની	ડીરેક્ટર	મો. ૯૪૨૬૨૮૬૪૧૩, ૨૨૨૪૩૦	૨૨૩૦૨૫
૪	શ્રી ધીરેન્દ્રકુમાર કે. મહેતા	ડીરેક્ટર	મો. ૯૮૨૫૮૩૬૬૮૦	
૫	શ્રી મહેન્દ્રભાઈ એન. મણીયાર	ડીરેક્ટર	મો. ૯૪૨૬૪૫૦૩૬૪, ૨૨૨૫૫૧	૨૨૨૩૬૩
૬	શ્રી શરદભાઈ એન. ગોરડીયા	ડીરેક્ટર	મો. ૯૪૨૮૬૩૮૩૭૩, ૨૨૨૧૫૦	૨૨૨૧૨૫
૭	શ્રી ધનસુખભાઈ ડી. રાહોડ	ડીરેક્ટર	મો. ૯૪૨૬૨૧૨૨૭૯	૨૩૧૨૩૯
૮	શ્રી યોગેશભાઈ આર. મહેતા	ડીરેક્ટર	મો. ૯૪૨૬૨૧૨૧૧, (૦૨૭૮) ૨૪૨૧૭૧૮	૨૫૬૧૭૧૮
૯	શ્રી પ્રકાશકુમાર એન. સલોત	ડીરેક્ટર	મો. ૯૪૦૯૦૮૦૬૭૨	
૧૦	શ્રી પ્રકાશકુમાર એમ. મહેતા	ડીરેક્ટર	મો. ૯૪૨૬૨૧૦૨૨૮	
૧૧	શ્રી પંકજભાઈ વી. જાની	ડીરેક્ટર	મો. ૯૮૨૫૩૧૬૫૦૪	
૧૨	શ્રી અશોકભાઈ એસ. મુની	ડીરેક્ટર	મો. ૯૮૨૫૩૫૪૫૬૨	
૧૩	શ્રીમતી ભાવનાબેન પી. કળથીયા	ડીરેક્ટર	મો. ૯૪૨૯૪૧૩૪૦૨	
૧૪	શ્રીમતી મીનાક્ષીબેન એમ. દવે	ડીરેક્ટર	મો. ૯૪૨૬૭૩૧૨૯૧	
૧૫	શ્રી શૈલેષભાઈ જે. દવે	પ્રો. ડીરેક્ટર	મો. ૯૦૩૩૭૪૧૪૮૨, ૮૮૪૯૭૬૦૭૭૯	



સ્મરણાંજલિ



સ્વ. ધનસુખભાઈ ડી. રાહોડ



સ્વ. જુતેન્દ્રભાઈ જી. જાની

બોર્ડ ઓફ મેનેજમેન્ટ

- (૧) શ્રી અશ્વિનભાઈ સી. ગોરડીયા
- (૨) શ્રી રાજેન્દ્રકુમાર ડી. જાની
- (૩) શ્રી અશોકભાઈ એસ. મુની
- (૪) શ્રી તરૂભાઈ કે. વોરા
- (૫) શ્રી લક્ષ્મણભાઈ વી. કાઠીયા
- (૬) શ્રી દાનજીભાઈ બી. કુહાડીયા
- (૭) શ્રી તારકભાઈ ડી. પારેખ

ઓફીસર્સ

શ્રી ધીરૂભાઈ એન. વાળા
શ્રી વામનભાઈ જે. મહેતા
શ્રી પ્રકાશભાઈ બી. મકવાણી
શ્રી અલ્પેશભાઈ કે. શેઠ

ઓડીટર્સ

ફોર, DSKHTP & Associates LLP
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
સીએ તેજસ રૂપાણી
FRN-119285W/W100631 M. No. 137309